



## સૌરાષ્ટ્ર આસપાસ

### એચઆઈવી સામે આશાનું નવું કિરણ

એચઆઈવીને નાબૂદ કરવાનો માર્ગ હવે વૈજ્ઞાનિકોને જડી ગયો હોવાની આશા જાગી છે. જર્મનીની યુનિવર્સિટી ઓફ કોલોનના વૈજ્ઞાનિકોએ શોધેલા નવા એન્ટિબોડી ૦૪-૯૦૬એ પ્રયોગશાળામાં ૯૮.૫ ટકા જેટલા ચકાસાયેલા છે. તેણે એચઆઈવી સ્ટ્રેનને રોકવાની ક્ષમતા દર્શાવી છે. હવે તેના ક્લિનિકલ પરીક્ષણો સફળ થાય અને મનુષ્યોમાં પણ તેની અસરકારકતા તથા સલામતી સાબિત થાય તો એચઆઈવીના સંક્રમણને રોકવા અને સારવારના ક્ષેત્રમાં ક્રાંતિકારી પદ્ધિવર્તન આવી શકે છે. એક દિવસ વિશ્વમાંથી એચઆઈવીને નાબૂદ કરવાની દિશામાં આ શોધ મહત્વનું પગલું બની શકે છે. જોકે, હાલ તેને અંતિમ સારવાર કે એચઆઈવીનો સંપૂર્ણ અંત લાવતી દવા માનવી વહેલું થશે.

વિશ્વમાં એચઆઈવી સામેની લડાઈને દાયકાઓ વીતી ગયા છે. એચઆઈવી શરીરની રોગપ્રતિકારક શક્તિને ધીમે ધીમે નબળી બનાવે છે અને યોગ્ય સારવાર ન મળે તો એઈડ્સ જેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ શકે છે. અત્યાર સુધીની દવાઓએ એચઆઈવી ધરાવતા લોકોનું જીવન લાંબું અને વધુ સારું બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. એન્ટિરેટ્રોવાયરલ સારવારથી શરીરમાં રહેલા વાયરસની માત્રા એટલી ઓછી કરી શકાય છે કે તે સામાન્ય પરીક્ષણોમાં શોધી પણ ન શકાય. છતાં શરીરમાં રહેલા વાયરસને સંપૂર્ણપણે દૂર કરવાની સમસ્યા યથાવત્ છે.આ પરિસ્થિતિમાં ૦૪-૯૦૬ એન્ટિબોડીની શોધ આશાનું નવું કિરણ બની છે. કોલોન યુનિવર્સિટીના સંશોધકોના નેતૃત્વ હેઠળ થયેલા અભ્યાસમાં આ એન્ટિબોડીએ ૩૦૦થી વધુ અલગ-અલગ એચઆઈવી સ્ટ્રેન સામે પરીક્ષણ દરમિયાન લગભગ ૯૮.૫ ટકા વાયરસને નિષ્ક્રિય કરવાની ક્ષમતા દર્શાવી હતી. ખાસ વાત એ છે કે આ એન્ટિબોડી વાયરસના એવા મહત્વપૂર્ણ ભાગને નિશાન બનાવે છે જેમાં મોટો ફેરફાર કરવો એચઆઈવી માટે સહેલો નથી. તેથી વાયરસમાં સામાન્ય રીતે જોવા મળતા કેટલાક ફેરફારો સામે પણ તેની અસર જળવાઈ રહી હતી.એચઆઈવી સામેની સારવારમાં સૌથી મોટો પડકાર વાયરસની બદલાવી પ્રકૃતિ છે. એચઆઈવી ઝડપથી પોતાના સ્વરૂપમાં ફેરફાર કરી શકે છે. પશ્ચિમે એક પ્રકારના વાયરસ સામે અસરકારક રહેલી દવા કે એન્ટિબોડી સામે સમય જતાં પ્રતિકાર ઊભો થઈ શકે છે.

## કંપની ન્યૂઝ

### એસેટ રિકન્સ્ટ્રક્શન ઇન્ડીયા લિમિટેડનો IPO આજથી ખુલ્યો



એસેટ રિકન્સ્ટ્રક્શન ઇન્ડિયા લિમિટેડનો ipo આજથી ખુલ્યો છે. ઇશ્યૂ ની પ્રાઈઝ બેન્ડ પ્રતિ ઈકિવટી શેર દીઠ ૧૩૨ થી ૧૩૯ રાખવામાં આવી છે. મીનીમમ ૧૦૭ ઈકિવટી શેર અને ત્યારબાદ ૧૦૭ ઈકિવટી શેર ના ગુણાંક માં અરજી કરાશે ઇશ્યૂ ૯ સપ્ટેમ્બર ના રોજ ખુલશે. બિડ/ઓફર બંધ થવાની તારીખ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ છે.

### રેન્ટોમોજો લિમિટેડનો IPO આજથી ખુલ્યો



રેન્ટોમોજો લિમિટેડનો ipo આજથી ખુલ્યો છે. ઇશ્યૂની પ્રાઈઝ બેન્ડ પ્રતિ ઈકિવટી શેર દીઠ રૂ. ૩૮૪ થી રૂ. ૪૦૪ રાખવામાં આવી છે. મીનીમમ ૩૭ ઈકિવટી શેર અને ત્યારબાદ ૩૭ ઈકિવટી શેર ના ગુણાંક માં અરજી કરાશે ઇશ્યૂ ૯ સપ્ટેમ્બર ના રોજ ખુલશે. બિડ/ઓફર બંધ થવાની તારીખ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ છે.

### મણિપાલ પેમેન્ટ એન્ડ આઈડેન્ટિટી સોલ્યુશન લિમિટેડનો IPO આજથી ખુલ્યો



મણિપાલ પેમેન્ટ એન્ડ આઈડેન્ટિટી સોલ્યુશન લિમિટેડનો ipo આજથી ખુલ્યો છે. ઇશ્યૂ ની પ્રાઈઝ બેન્ડ પ્રતિ ઈકિવટી શેર દીઠ રૂ. ૩૨૨ થી રૂ. ૩૩૯ રાખવામાં આવી છે. મીનીમમ ૪૪ ઈકિવટી શેર અને ત્યારબાદ ૪૪ ઈકિવટી શેર ના ગુણાંક માં અરજી કરાશે ઇશ્યૂ ૯ સપ્ટેમ્બર ના રોજ ખુલશે. બિડ/ઓફર બંધ થવાની તારીખ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ છે.

### પ્રાસોલ કેમિકલ લિમિટેડનો IPO ૮ સપ્ટેમ્બરથી ખુલી ગયો છે



પ્રાસોલ કેમિકલ લિમિટેડ નો ipo ૮ સપ્ટેમ્બરથી ખુલી ગયો છે. ઇશ્યૂની પ્રાઈઝ બેન્ડ પ્રતિ ઈકિવટી શેર દીઠ રૂ. ૬૪૩ થી રૂ. ૬૭૬ રાખવામાં આવી છે. મીનીમમ ૨૨ ઈકિવટી શેર અને ત્યારબાદ ૨૨ ઈકિવટી શેર ના ગુણાંક માં અરજી કરાશે ઇશ્યૂ ૮ સપ્ટેમ્બર ના રોજ ખુલશે. બિડ/ઓફર બંધ થવાની તારીખ ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ છે.

## ૨૦૧૪માં એનડીએ સરકાર સત્તામાં આવ્યા પછી ૨૮૦૦ કિલોમીટરનો કોરિડોર ૧૨ વર્ષમાં પૂર્ણ થયો

### પીએમ મોદીએ સમગ્ર વેસ્ટર્ન ડેડિકેટેડ ફેઈટ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું

વડોદરા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે મહારાષ્ટ્ર અને ગુજરાતની મુલાકાત કરી. આ દરમિયાન, તેઓ રૂ. ૩૫,૦૦૦ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ વડોદરામાં વેસ્ટર્ન ડેડિકેટેડ ફેઈટ કોરિડોરના ત્રણ વિભાગોનું ઉદ્ઘાટન કર્યું, જે કુલ ૩૨૬ કિલોમીટર લાંબા છે. આ ઉદ્ઘાટન સાથે, ગૌતમ બુદ્ધ નગરના આયોજન પછીના ૧૦ વર્ષ દરમિયાન આ કોરિડોર પર કામ અટકી ગયું હતું. ૨૦૧૪માં એનડીએ સરકાર સત્તામાં આવ્યા પછી, ૨,૮૦૦ કિલોમીટરનો કોરિડોર ૧૨ વર્ષમાં પૂર્ણ થયો. આનાથી માલગાડીઓની ગતિ

૨૫ થી વધીને ૬૫ કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ છે. માલગાડીઓ, જે પહેલા ૧૦૦ કિમીનું અંતર કાપવામાં કલાક લેતી હતી, હવે ત્રણ કલાકથી ઓછા સમય લે છે. કોરિડોરના ત્રણ વિભાગો પર ૨૦,૭૦૦ કરોડથી વધુનો ખર્ચ થયો છે. આમાં સાણંદ-મકરપુરા, ન્યુ ઉમ્મરગાંવ-ન્યુ સફેલ અને ન્યુ સફેલ-જેએનપીટી સેક્શનનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ ન્યુ સાણંદ નોર્થ, ન્યુ મકરપુરા, ન્યુ ઉમ્મરગાંવ અને ન્યુ જેએનપીટી મુંબઈથી માલગાડી ટ્રેન સેવાઓને પણ લીલી ઝંડી આપી હતી. તેમણે વડોદરા અને ટાંડા રોડ વચ્ચે નવી

ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપી હતી. આનાથી વડોદરા, છોટા ઉદેપુર અને અલીરાજપુર જિલ્લાઓને ફાયદો થશે. વેસ્ટર્ન ડેડિકેટેડ ફેઈટ કોરિડોરની ૧,૫૦૬ કિલોમીટર લાંબી ડબલ રેલ લાઈન ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરના દાદરીથી જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ, નવી મુંબઈ, મહારાષ્ટ્ર સુધીની છે. આ સેક્શન ઉત્તર પ્રદેશમાં ૧૮ કિમી, હરિયાણામાં ૧૭૭ કિમી, રાજસ્થાનમાં ૫૬૭ કિમી, ગુજરાતમાં ૫૬૫ કિમી અને મહારાષ્ટ્રમાં ૧૭૭ કિમી આવરી લે છે. તે ડબલ-સ્ટેક કન્ટેનર ટ્રેનો

## ૫૦૦ પુરુષોએ ડમરુ વગાડી અને ૩૦ બહેનોએ ઢોલ-ત્રાંસા સાથે પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું

### નવસારીમાં વડાપ્રધાન મોદીએ એઆઈ આધારિત ‘નમો કમલમ’નું લોકાર્પણ કર્યું



નવસારી, વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી પહોંચ્યા હતા, જ્યાં તેમણે નેશનલ હાઈવે ગ્રીડ નજીક ભાજપના દેશના પ્રથમ એઆઈ (કૃત્રિમ બુદ્ધિમત્તા) આધારિત અત્યાધુનિક કાર્યાલય ‘નમો કમલમ’નું ભવ્ય લોકાર્પણ કર્યું હતું. આ ઐતિહાસિક પ્રસંગને લઈને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર નવસારી જિલ્લામાં ભારે ઉત્સાહનો

ડમરુ વાદન કરી વાતાવરણને શિવમય બનાવ્યું હતું, જ્યારે ૩૦ બહેનોએ ઢોલ-ત્રાંસાના તાલ સાથે પરંપરાગત વાદ્યો વગાડી સમગ્ર પરિસરને ગજવી નાખ્યું હતું. લોકાર્પણ બાદ વડાપ્રધાનશ્રીએ ‘નમો કમલમ’ પરિસરની મુલાકાત લઈ તેની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે મુખ્ય કાર્યાલય, અદ્યતન મીડિયા સેન્ટર અને ડિજિટલ કોલ સેન્ટરની કાર્યપ્રણાલીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેમણે આધુનિક લાઈબ્રેરી, સોસલ અને ધારાસભ્ય માટેની ખાસ કેબિન તેમજ પંડિત દીનદયાલ મીઠિંગ હોલ, ડો. શ્યામાપ્રસાદ મુખર્જી હોલ અને અટલ સભાખંડની પણ મુલાકાત લીધી હતી. આ ઐતિહાસિક કાર્યક્રમના સીધા પ્રસારણ માટે જિલ્લાભરમાં વ્યાપક ડિજિટલ આયોજન કરાયું હતું.

વડોદરા, ગુજરાતના વડોદરામાં ‘નમો ફોર વિકાસ ભારત’ કાર્યક્રમમાં પીએમ મોદીની અનોખી શૈલી જોવા મળી. પીએમ મોદી કાર્યક્રમમાં હાજર યુવાનોને ઉત્સાહપૂર્વક મળ્યા. જનરલ ઝેડ પ્રત્યેનો તેમનો અભિગમ નોંધપાત્ર હતો. સ્ટેજ પર, પીએમ મોદીએ હાથ લહેરાવીને હાજર યુવાનોનું અભિવાદન સ્વીકાર્યું. તેઓ ત્યાં અટક્યા નહીં. તેઓ આગળ વધ્યા અને તેમની સાથે સીધી વાતચીત કરી. આ કાર્યક્રમ દરમિયાન હાજર જનરલ ઝેડ લોકો ખૂબ ખુશ હતા. દરેકના મોબાઈલ ફોનના કેમેરા પીએમ મોદી પર કેન્દ્રિત હતા. યુવાનોનો ઉત્સાહ જોઈને પીએમ



ઉત્સાહ ખૂબ જ હતો. કાર્યક્રમ દરમિયાન, પીએમ મોદીએ જેનજ સાથે સીધો સંવાદ કર્યો. પીએમએ કહ્યું, “વિકસિત ભારત તરફની યાત્રાને વધુ વેગ આપવા માટે હું આજે તમારી વચ્ચે આવ્યો છું.” પીએમ મોદીએ કહ્યું કે તમને દરેક ચોક્કસ પર જુદાજુદા પડ્યા જોવા મળશે, પાર્ટી ભારતના યુવાનો સત્યની ગર્જના સાથે છે.

## સોનીના સીધા હોર્ડર્સ સ્ટ્રિંગરની સફળતાની સફસેસ સ્ટોરી

સોની કંપનીનો જન્મ ૧૯૪૬માં થયો હતો. તે વખતે જાપાન યુદ્ધમાં હારી ગયું હતું. અમેરિકાના બોમ્બથી ચારેકોર વિનાશ ફેલાયો હતો. લોકો ઘર વગરના હતા. હજારો લોકો ભૂખ્યા અને તરસ્યા હતા. બધા ધંધા ભાંગી પડ્યા હતા. દેશમાં ગરીબી હતી. આવા કપરા સમયે બે યુવાનોએ એક નાનું સપનું જોયું. તેમના નામ મસારા ઇબુકા અને અકિયો મોરિતા હતા. તેમણે ટોક્યોમાં એક નાની દુકાન શરૂ કરી. તેનું નામ ટોક્યો ત્સુશીન કોચ્યો હતું. તેમની પાસે માત્ર એક લાખ નેપ્યું હજાર ચેન હતા.

દુનિયામાં ગમે ત્યાં સરળતાથી બોલી શકાય છે. ૧૯૬૦માં સોનીએ અમેરિકામાં પોતાની કંપની ખોલી. ૧૯૭૯માં વોકમેન આવ્યું. આ દુનિયાનું પહેલું નાનું સંગીત યંત્ર હતું. લોકો ગમે ત્યાં સંગીત સાંભળી શકતા હતા. પછી સોનીએ ટીવી, કેમેરા અને રમતનું યંત્ર બનાવ્યું. આજે સોની ચાર મોટા કામ કરે છે. યંત્રો, ફિલ્મ, સંગીત અને રમત. નાના બીજમાંથી આજે મોટું ઝાડ બન્યું છે. સોનીની સફળતાને આગળ લઈ જનાર વ્યક્તિ હોર્ડર્સ સ્ટ્રિંગર છે. મુશ્કેલી એ જ તક છે જે સામાન્ય લોકોને દેખાતી નથી. આ તેમના

ભાગો એકબીજા સાથે લડતા હતા. કોઈ એકબીજાની વાત સાંભળતું ન હતું. સ્ટ્રિંગરે નવો નારો આપ્યો. તેમણે કહ્યું કે સોનીને એક કરવી પડશે. યંત્ર અને વાર્તા સાથે કામ કરશે તો જ સોની આગળ વધશે. તેમણે કંપનીના ખર્ચ ઘટાડ્યા. તેમણે જૂના કારખાના બંધ કરાવ્યા. તેઓ ટોક્યોમાં કામ કરતા હતા. પણ તેમનું ઘર ન્યૂયોર્કમાં હતું. પરિવાર ઈંગ્લેન્ડમાં રહેતો હતો. છતાં તેમણે હાર ન માની. વડા બન્યા પછી સમય સરળ ન હતો. જાપાની નાણું મજબૂત થવાથી સોનીના યંત્રો મોંઘા થઈ ગયા. ૨૦૦૮માં દુનિયામાં મંદી આવી. લોકોએ ટીવી અને કેમેરા ખરીદવાનું ઓછું

અશક્ય કામને શક્ય કરવાનો વિચાર આવે તો તમે સફળતાના સાચા રસ્તે છો. આપું દુનિયાભરમાં જાણીતી સોની કંપની કહે છે. દુનિયામાં જે કામ અશક્ય લાગે તે કામ પણ માણસ ધારે તો કરી શકે છે. સોનીના વડા એવું માનતા હતા કે જે કામ કોઈએ નથી કર્યું તે કરી બતાવવું એ જ સાચી હિંમત છે. તેમણે આ વાત કરી બતાવી. એટલે જ જાપાનની સોની કંપની આજે પણ દુનિયામાં સૌથી આગળ છે.

આસપાસ ચોપાર સુરેશ ભટ્ટ

તેમની સાથે વીસ કામદારો હતા. તેમણે એક નાનો લેખ લખ્યો. તેમાં લખ્યું હતું કે અમારે એવો કારખાના બનાવવા છે જ્યાં ખુલ્લા મને કામ થાય. નવી શોધથી જાપાની સંસ્કૃતિને આગળ લઈ જવી એ અમારો હેતુ છે. આ વિચાર ખૂબ મોટો હતો. તૂટેલા દેશમાં બેઠેલા બે યુવાનો આકાશને આંબવાનું વિચારતા હતા. આ જ તેમની પહેલી જીત હતી. શરૂઆતમાં તેમણે ટેપ રેકોર્ડ બનાવ્યું. પછી જાપાનનું પહેલો નાનો રેડિયો બનાવ્યો. આ રેડિયો અમેરિકામાં ખૂબ વેચાયો. ૧૯૫૮માં કંપનીનું નામ સોની રાખવામાં આવ્યું. સોની શબ્દ અવાજ અને ખુશી એવા અર્થવાળા બેશબ્દોને જોડીને બન્યો છે. આ નામ

એક કાર્યક્રમમાં ફોન ઉપાડાતા હતા. છ અઠવાડિયા પછી તેમને લશ્કરમાં જવું પડ્યું. તે સમયે વિયેતનામ યુદ્ધ ચાલતું હતું. તેમણે દસ મહિના સેવા આપી. સારી સેવા માટે તેમને ચંદ્રક મળ્યો. આ અનુભવે તેમને શિસ્ત અને હિંમત શીખવી. લશ્કરમાંથી પાછા આવીને તેઓ ફરી તે જ કંપનીમાં જોડાયા. હવે તેમની સાચી સફર શરૂ થઈ. તેઓ ધીમે ધીમે આગળ વધ્યા. ૧૯૮૬માં તેઓ સમાચાર વિભાગના વડા બન્યા. ૧૯૮૮થી ૧૯૯૫ સુધી તેઓ આખા નેટવર્કના વડા રહ્યા. આ સમયમાં તેમણે નવ મોટા એવોર્ડ જીત્યા. ત્રીસ વર્ષ એક જ કંપનીમાં કામ કરીને તેમણે બતાવ્યું કે સાચા મનથી કામ કરવાથી મોટી સફળતા મળે છે.

કર્યું. ૨૦૧૧માં જાપાનમાં મોટો ધરતીકંપ થયો. તેનાથી સોનીના ઘણા કારખાના બંધ થઈ ગયા. આ તોફાન વચ્ચે પણ સ્ટ્રિંગરે બે સારા નિર્ણયો લીધા. પહેલો નિર્ણય બીજા કંપની સાથે હાથ મિલાવવાનો હતો. તેમણે સાથે મળીને ટીવી માટે સારી સ્ક્રીન બનાવવાનું શરૂ કર્યું. આનાથી સોનીને સારા ટીવી બનાવવામાં મદદ મળી. બીજો નિર્ણય નાની સંગીત કંપનીમાં પૈસા રોકવાનો હતો. ઘણા લોકોને લાગ્યું કે આ નકામું રોકાણ છે. પણ સ્ટ્રિંગરે ભવિષ્ય જોયું. પાછળથી સોનીને તેમાંથી મોટો નફો થયો. આ તેમની દૂરની નજરનું ઉદાહરણ છે. તેમણે સોનીની અંદરની સમસ્યા પણ ઓળખી. તેમણે કહ્યું કે સોનીમાં જ એવી ભાવના છે કે અમે નથી બનાવ્યું તો તે સારું નથી. આ ભાવનાએ સોનીને નુકસાન પહોંચાડ્યું છે.



# અમરેલી જિલ્લામાં તા. ૨૧ સપ્ટેમ્બરથી તા. ૯ ઓક્ટોબર સુધી સેવા સેતુ ૨.૧ ગ્રામ્ય યોજાશે

## સેવા સેતુ ૨.૧ ના પ્રથમ તબક્કામાં તા. ૧૯ સપ્ટેમ્બર સુધી લાભાર્થીઓને લાભ આપવા જરૂરી દસ્તાવેજોની કામગીરી પૂર્ણ કરાશે

અમરેલી: રાજ્ય સરકારની વ્યક્તિલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચાડવાના હેતુથી નવીન કાર્યપદ્ધતિના ભાગરૂપે અમરેલી જિલ્લામાં તા. ૨૧ સપ્ટેમ્બરથી તા. ૦૯ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન સેવા સેતુ ૨.૧ ગ્રામ્ય યોજાશે. સેવા સેતુ અંતર્ગત વિવિધ સરકારી સેવાઓ અને વ્યક્તિલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને તેમના નજીકના સ્થળે મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

સેવા સેતુ ૨.૧ ગ્રામ્યના પ્રથમ તબક્કા અંતર્ગત તા. ૧૯ સપ્ટેમ્બર સુધી લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે જરૂરી દસ્તાવેજો તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લા પંચાયતની બેઠક દીઠ સેવા સેતુ કાર્યક્રમ યોજી, વિવિધ સરકારી યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓને આપવામાં આવશે.

સેવા સેતુ ૨.૧ ગ્રામ્યના સફળ અને સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને મંગળવારે અમરેલી જિલ્લા

સેવાસદન ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સેવા સેતુ શરૂ થાય તે પહેલાંના પ્રથમ તબક્કામાં જ જરૂરી સેવાઓની કામગીરી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

પ્રથમ તબક્કામાં તમામ ગામોમાં આધાર નોંધણી અને આધારમાં સુધારા, આઈ.સી.ડી.એસના બાળકોના આધાર કાર્ડ, રેશનકાર્ડ સંબંધિત સેવાઓમાં નામ દાખલ કરવા, નામ કમી કરવા તેમજ સુધારા અને ઈ-કે.વાય.સી જેવી સેવાઓ સુનિશ્ચિત કરવા જણાવાયું હતું.

આ ઉપરાંત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મહેસુલી રેકર્ડમાં વારસાઈની એન્ટ્રી, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને તેને સંબંધિત યોજનાઓ, બેન્કિંગ સંબંધિત સેવાઓ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, સોઈલ હેલ્થ કાર્ડ, માતૃશક્તિ, નમોશ્રી, આઈસીડીએસ બાળકોના આધાર કાર્ડ, ખાતેદાર ખેડૂતના નમૂના નં. ૭/૧૨ સાથે આધારકાર્ડનું જોડાણ તથા કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની કુલ ૧૨ સેવાઓમાં પાત્ર લાભાર્થીઓને લાભ મળે તે માટે પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવશે.

જિલ્લા કલેક્ટરશ્રીએ રાજ્ય સરકારના પરિપત્ર મુજબ સેવા સેતુ ૨.૧ના પ્રથમ તબક્કાની કામગીરી સમયમર્યાદામાં ૧૦૦ ટકા પૂર્ણ કરવા તેમજ ત્યારબાદ કેમ્પ દરમિયાન હાથ ધરાનારી બીજા તબક્કાની કામગીરીનું પણ સુચારુ આયોજન કરી દરેક પાત્ર લાભાર્થી સુધી યોજનાનો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

બેઠકમાં સુપર ન્યૂમરરી આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી હર્ષિતા ગોયલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એ.એ. ડોડિયા, પ્રાંત અધિકારીશ્રી અમરેલી-કુકાવાવ જાડેજા, પ્રાંત અધિકારીશ્રી ધારી-ખાંભા શ્રી અર્પણ ચાવડા, પ્રાંત અધિકારીશ્રી બગસરા-વડિયા શ્રી કમલેશ નંદા, પ્રાંત અધિકારીશ્રી લાડી-બાબરા શ્રી પારસ ચૌહાણ, પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા-લીલીયા શ્રી ઝીલ પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, અગ્રણી શ્રી અતુલ ભાઈ કાનાણી, શ્રી રાજુભાઈ ભુતૈયા, શ્રી મેહુલભાઈ ધોરાજયા, શ્રી દિવ્યેશ ભાઈ વેકરીયા, ઉપસ્થિત રહ્યા હતા.

# ઉનામાં રાત્રે સિંહોની લટાર, હાઈવે પર કાર નજીકથી સિંહ પસાર



કૈલેશ ભટ્ટ ઉના: ઉના પંથકમાં એક જ રાત્રે અલગ-અલગ જગ્યાએ સિંહોના આંટોકેરા જોવા મળ્યા હતા. સિંહોને રોડ કોસ કરતો દેખાયો હતો. સિંહોને રોડ કોસ કરતો જોઈને ત્યાંથી પસાર થતી કારના ડ્રાઈવરે ગાડી રોકી દીધી હતી. સિંહ કારની એકદમ નજીકથી પસાર થઈ ગયો હતો, જેનો વીડિયો વાહનચાલક પોતાના પોબાઈલમાં બનાવ્યો હતો ચોવીસ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી ઉના પંથકમાં સિંહોની આવ-જા વધી રહી છે. ગત રાત્રે ઉના-ભાવનગર નેશનલ હાઈવે, ગરાળ-સુતાલનપુર રોડ, રૂડવડલી ગામ સહિતના અલગ-અલગ વિસ્તારોમાં સિંહો ફરતા જોવા મળ્યા હતા. આ દૃશ્યો સામે આવતા સિંહપ્રેમીઓ પણ સિંહ જોવા માટે ત્યાં પહોંચ્યા હતા.

ઉના-ભાવનગર નેશનલ હાઈવે પર એક સિંહ રોડ કોસ કરતો દેખાયો હતો. સિંહોને રોડ કોસ કરતો જોઈને ત્યાંથી પસાર થતી કારના ડ્રાઈવરે ગાડી રોકી દીધી હતી. સિંહ કારની એકદમ નજીકથી પસાર થઈ ગયો હતો, જેનો વીડિયો વાહનચાલક પોતાના પોબાઈલમાં બનાવ્યો હતો ચોવીસ પોતાના મોબાઈલમાં બનાવ્યો હતો. ચોવીસ કલાક વાહનોની અવરજવર ધરાવતા આ હાઈવે પર સિંહની આ લટાર સિંહ અને વાહનચાલકો બંને માટે જોખમી બની શકે છે.

# વરસાદ ખેંચાય તે સમયે ખેડૂતો માટે કૃષિ વિભાગની ખાસ માર્ગદર્શિકા

મર્યાદિત પાણી હોય ત્યારે ખેતીમાં ટપક કે ફુવારા પદ્ધતિ અપનાવવી:વધારાના અને નબળા છોડ ત્વરિત ઉપાડી લેવાથી મુખ્ય પાકને પૂરતું પાણી અને પોષણ મળશે

અમરેલી: વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ (ખેતી નિયામકની કચેરી) દ્વારા ઊભા પાકને રક્ષણ આપવા અને જમીનમાં ભેજ જાળવી રાખવા માટે ખેડૂતો માટે ખેતીમાં કાળજી લેવાના પગલાં જણાવવામાં આવ્યા છે.



જમીન અને પાકની અવસ્થા મુજબ સમયસર આંતર-ખેડ કરવી. નીંદણ દૂર કરવાથી જમીનનો ભેજ અને પોષકતત્વો મુખ્ય પાકને પૂરતા પ્રમાણમાં મળી રહે છે. બે ચાસ વચ્ચે સૂકું ઘાસ, પાંદડા કે પ્લાસ્ટિકનો મલ્ટિંગ કરવું. તેનાથી જમીનમાંથી પાણીનું બાષ્પીભવન અટકે છે અને ભેજ લાંબો સમય ટકી રહે છે. મર્યાદિત પાણી હોય ત્યારે ધોરિયા પદ્ધતિને બદલે ટપક કે ફુવારા પદ્ધતિ અપનાવવી, જેનાથી

પાણીનો મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે. પાકની કટોકટીની અવસ્થા (જેમ કે ફૂલ આવવાની કે દાણા ભરાવાની અવસ્થા) દરમિયાન ખાસ પિયત આપવું. પાણી ખૂબ જ ઓછું હોય તો એકાંતર ચાસે (એક ચાસ મૂકીને એક ચાસમાં) પિયત આપવું. ભેજની અછત સામે છોડને ટકાવી રાખવા માટે એકથી બે ટકા યુરિયા અથવા પોટેશિયમ નાઈટ્રેટ

(૧૩:૦:૪૫) ના દ્રાવણનો પાક પર છંટકાવ કરવો, જેથી છોડની રોગપ્રતિકારક શક્તિ અને તણાવ સહન કરવાની ક્ષમતા વધે છે. જમીનમાં ભેજ ખૂબ ઓછો હોય ત્યારે વધારાના અને નબળા છોડ ઉપાડીને પારવણી કરવી, જેથી બાકીના છોડને પૂરતો ભેજ મળી રહે. પાક પરિપક્વતાની અવસ્થાએ પહોંચે ત્યારે સમયસર કાપણી કરી લેવી.

આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નામખ ખેતી નિયામક (તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ડેલ ફી નંબર - ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ ઉપર સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

# અમરેલી રેલ પ્રોજેક્ટની ગોકળગતિએ થતી કામગીરીના કારણે બ્રોડગેજ પ્રોજેક્ટ પૂરો થતો નથી

અમરેલી ખીજડીયા ટ્રેકનું ટેસ્ટિંગ થયા પછી પાછા પાટા કાઢી નાંખ્યા, હવે ફરી જમીન સંપાદનની જાહેરાત

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી: અમરેલી શહેર માટે બ્રોડગેજ રેલવે એક સ્વપ્નનું જ બની રહેશે? અગાઉ અમરેલી-ખીજડીયા વચ્ચે બ્રોડગેજ રેલવે લાઈનના પાટા નાંખી અને તેના ઉપર ટ્રેન દોડાવી અને સફળ ટેસ્ટિંગની કામગીરી થઈ ગયા બાદ હવે કેટલાક સ્થળે પાટા કાઢી નાખવામાં આવ્યા છે. આવી સ્થિતિ વચ્ચે હવે ફરી જમીન સંપાદન માટે બે અલગ અલગ જાહેરાતો પ્રસિદ્ધ થતાં બ્રોડગેજ કામગીરીની આયોજન પ્રક્રિયા સામે પ્રશ્નો ઊભા થયા છે. લાંબા સમયથી જમીન સંપાદનની પ્રક્રિયા ચાલતી હોવા છતાં ટેસ્ટિંગ બાદ ફરી જમીનની જરૂરિયાત પ્રશ્ન થયો અને તેના માટે નવેસરથી જાહેર નામાં બહાર પાડવામાં આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

અમરેલી-ખીજડીયા વચ્ચે બ્રોડગેજ રૂપાંતરની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે. તાજેતરમાં નવી નાખવામાં આવેલી રેલવે લાઈન પર એન્જિન દ્વારા ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ બાદ રેલવે સેવા શરૂ થવાની આશા વચ્ચે અચાનક કેટલાક સ્થળે પાટા કાઢી નાખવામાં આવ્યા હતા. હવે ગત તા. ૨૫ ઓગસ્ટ, ૨૬ના રોજ જમીન સંપાદનને લગતી બે અલગ જાહેરાતો પ્રસિદ્ધ થતાં બ્રોડગેજ કામગીરીમાં ફરી એક વખત જમીનનો પ્રશ્ન સામે આવ્યો છે. જાહેરાતોમાં દર્શાવાયેલી જમીન સંપાદનની કાર્યવાહી અગાઉની પ્રક્રિયાઓના અનુસંધાનમાં હોવાનું પણ સામે આવ્યું છે. એટલે જમીન સંપાદનનો પ્રશ્ન નવી રીતે ઊભો થયો છે કે અગાઉની કાર્યવાહી અધૂરી રહી હતી અથવા હવે



જરૂરિયાત ઊભી થઈ છે, તે અંગે સ્પષ્ટતા જરૂરી બની છે. અગાઉ પણ આ જ વિસ્તારમાં જમીન સંપાદન માટેની કાર્યવાહી અને જાહેરાતો પ્રસિદ્ધ થઈ ચૂકી છે. જમીન સંપાદનની પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી હોવા છતાં

પહેલા રેલવે ટ્રેક તૈયાર કરવામાં આવ્યો, તેના પર ટેસ્ટિંગ પણ થયું અને ત્યારબાદ પાટા કાઢી નાખવાની સ્થિતિ અને હવે જમીન સંપાદન માટે ફરી જાહેરનામાં પ્રસિદ્ધ થતાં બ્રોડગેજ કામગીરી કચારે સંપૂર્ણ રીતે જાહેરાતો બહાર આવતાં સમગ્ર આયોજન અને કામગીરીના ક્રમ સામે સવાલો ઊભા થયા છે. મહત્વની બાબત એ છે કે રેલવે મંત્રાલયની જુલાઈ, ૨૦૨૬ની સત્તાવાર માહિતીમાં રૂ.૧૭૮ કરોડના અંદાજિત ખર્ચવાળી ૧૭ કિલોમીટર ખીજડીયા-અમરેલી ગેજ કન્વર્ઝન યોજના હજુ ચાલુ પ્રોજેક્ટ તરીકે દર્શાવવામાં આવી છે. બીજી તરફ માર્ચના અંતમાં આ રૂટ પર એન્જિન ટ્રાયલ કરવામાં આવ્યું હોવાનું જાહેર થયું હતું.

અમરેલીમાં વર્ષોથી વેરાવળ અને જુનાગઢ વચ્ચે ચાલતી મીટરગેજ લાઈન પણ બ્રોડગેજ લાઈન મેળવવાની આશામાં ખોઈ છે. અગાઉ ચાલતી મીટરગેજ લાઈન બ્રોડગેજની કામગીરીના કારણે દ મહિના માટે બંધ કરવામા આવી હતી તે આજે બે વર્ષથી બંધ થયા બાદ હજુ સુધી શરૂ થઈ શકેલ નથી. આમ મીટરગેજ લાઈન પણ અમરેલીના લોકો ખોઈ ચુક્યા છે.

# હવે અમરેલીમાં થઈ શકશે ઓર્ગન ડોનેશન, આસ્થા હોસ્પિટલને મળી અંગદાન પ્રક્રિયાની મંજૂરી

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી: રાજ્ય સરકારની આયોજાઈઝ કમિટી દ્વારા માનવ શરીરના અંગોને પ્રત્યાપ્તિ કરવા? માટે અમરેલીની સુવિખ્યાત અને જરૂરી સુવિધાથી સજ્જ આસ્થા હોસ્પિટલને ઓર્ગન ડોનેશન પ્રક્રિયા માટે ૧૯૯૮ના કાયદા મુજબ માન્યતા આપવામાં આવી છે.



અમરેલીના જાણીતાં અને અનુભવી ફિઝિશિયન ડૉ. અશોક પરમારે જણાવ્યું હતું કે, આસ્થા હોસ્પિટલને હુમલ ઓર્ગન ડોનેશન એક્ટ હેઠળ મંજૂરી મળતાં આનંદ સાથે ગૌરવની લાગણી અનુભવું છે તેમજ આધુનિક ટેકનોલોજી સાથે મેડિકલ ફિલ્ડમાં આવેલ સાયન્ટિફિક ક્રાંતિ મુરઝતી માનવ જિંદગી બચાવવા ખૂબ મહત્વની સાબિત થઈ છે. આ સેવાથી જરૂરિયાત મંદ દર્દીઓનું જીવન બચાવવા સહિયારો પ્રયત્ન કરીશું અને ઓર્ગન ડોનેશન અંતર્ગત ડોનાર પાસેથી હોસ્પિટલ તરફથી કોઈપણ પ્રકારનો

રાષ્ટ્રધર્મને વરેલ સંસ્થા સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી જેમને તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આઈ ડોનેશન અવેરનેસ, બ્લડ ડોનેશન એક્ટિવિટી સહિત સેવાકીય કાર્યો બદલ સન્માનિત કરવામાં આવેલ તેમને "ઓર્ગન ડોનેશન અવેરનેસ" માટે વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. અમરેલી જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ, સેવાભાવી વ્યક્તિઓ, હોસ્પિટલ્સ, ડોક્ટર્સ તેમજ વોલન્ટિયર્સ સાથે લઈ અંગદાન પ્રવૃત્તિ બાબતે જાગૃતિ ફેલાવવાનું કાર્ય હાથ ધરવામાં આવશે. તેમ? સંવેદન ગૃપ દ્વારા જણાવાયું છે.

# ઉના-ગીરગઢડામાં વરસાદ ખેંચાતા મગફળી સહિતના પાકો સુકાયા ખેડૂતે દ વીધાના ઉભા પાકમાં ટ્રેક્ટર ફેરવી દીધું, ૧૫-૨૦ હજારનો ખર્ચ માથે પડ્યો

કૈલેશ ભટ્ટ ઉના:ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેતી પર મોટું સંકટ આવ્યું છે. ખાસ કરીને ઉના અને ગીરગઢડા તાલુકામાં મગફળી સહિતના પાકને જેનાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સારા વરસાદની આશાએ ખેડૂતોએ બિયારણ, ખાતર, દવા, વાવણી અને મજૂરી પાછળ ઘણો ખર્ચ કર્યો હતો. ખેડૂતોના કહેવા મુજબ, એક વીધા મગફળી પાછળ અંદાજે ૧૫થી ૨૦ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. પરંતુ વરસાદ ન આવતા પાકને જરૂરી ભેજ મળ્યો નથી, જેના કારણે મગફળીનો વિકાસ અટકી ગયો છે. કેટલીક જગ્યાએ પાક બચાવવાની કોઈ આશા ન રહેતા ખેડૂતો ઉભા

પાકમાં ટ્રેક્ટર અને રોટાવેટર ફેરવી રહ્યા છે. ઉના તાલુકાના રેવદ ગામના ખેડૂત અરજણભાઈ જાખોગાએ સોંખડા ગામની દ વીધા જમીનમાં મગફળી વાવી હતી. વરસાદ ન મળવાને કારણે પાક પીળો પડીને સુકાઈ ગયો. છેવટે, પાક બચાવવાની કોઈ આશા ન રહેતા તેમણે ભારે હૃદયે દ વીધાના ઉભા પાકમાં ટ્રેક્ટર ફેરવી દીધું. ખેડૂત ધર્મેશભાઈએ જણાવ્યું કે તેમણે આશરે ૩૦ વીધામાં

મગફળી અને ડુંગળી વાવી હતી. વરસાદ ન હોવાને કારણે અને સિંચાઈ માટે પાણીની અછત સર્જતા પાક િન પ ફળ જ વા ની સ્થિતિમાં છે. આ ઉપરાંત, ખેડૂત સવજભાઈએ પણ જણાવ્યું કે તે મ ની મળવાને કારણે પાક પીળો પડીને સુકાઈ ગયો. છેવટે, પાક બચાવવાની કોઈ આશા ન રહેતા તેમણે ભારે હૃદયે દ વીધાના ઉભા પાકમાં ટ્રેક્ટર ફેરવી દીધું. ખેડૂત ધર્મેશભાઈએ જણાવ્યું કે તેમણે આશરે ૩૦ વીધામાં

મુશ્કેલ બની છે. ખેડૂત ભરતભાઈ વાઢેરાના કહેવા મુજબ, વરસાદ અને વીજળી સપ્લાયની બેવડી સમસ્યાથી પાક બચાવવો મુશ્કેલ બન્યો છે. સપ્લાયની બેવડી સમસ્યાથી પાક બચાવવો મુશ્કેલ બન્યો છે. ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક પાક નુકસાનનો સર્વે કરાવે. તેઓ ગીર સોમનાથ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને રાહત પેકેજ આપવાની પણ માંગ કરી રહ્યા છે. ખેતી માટેની લોન, વીજળીના બિલ અને અન્ય આર્થિક બોજમાં રાહત આપવા સાથે નિયમિત ખેતીવાડી વીજળી સપ્લાય આપવાની પણ માંગ ઉઠી છે. ખેડૂતોને ડર છે કે જો વરસાદ વધુ ખેંચાશે તો ઘાસચારા અને પાણીની સમસ્યા પણ ગંભીર બનશે.

# ગુજરાતની શાળાઓમાં હવે વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ ફરજિયાત

અમરેલી: ગુજરાતના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્વપૂર્ણ અને અંે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હવે વિદ્યાર્થીઓને તણાવમુક્ત વાતાવરણ પૂરું પાડવા અને માનસિક કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે કાઉન્સેલિંગ પ્રક્રિયા ફરજિયાત કરતાં વધુ છે, ત્યાં તાલીમબદ્ધ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪માં નવો વિનિયમ ૧૬(અ) ઉમેરવામાં

આવ્યો છે. સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાના આધારે રાજ્યમાં ધોરણ ૯થી ૧૨ સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં 'વેલનેસ ટીમ'ની રચના કરવામાં આવશે. આ ટીમમાં વિદ્યાર્થીઓને માનસિક રીતે મજબૂત બનાવવામાં મદદ કરવા માટે 'મનો મિત્ર'ની પણ નિયુક્તિ કરાશે. આ સાથે જ જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦૦ કરતાં વધુ છે, ત્યાં તાલીમબદ્ધ કાઉન્સિલર અથવા સાયકોલોજિસ્ટની નિયુક્તિ કરવી હવે થી અનિવાર્ય રહેશે.

# જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ રેડીયમ રીફલેક્ટર વગર ખેતીવાડીમાં વપરાતા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે

અમરેલી: અમરેલી કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાની માર્ગ સલામતીની વિવિધ કામગીરી પાબતે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં સ્પીડ બ્રેકિંગ, નિયમ મુજબનાં સાઈનને બોર્ડ લગાવવા, વૃક્ષનું યોગ્ય સમયે ટ્રીમીંગ કરાવવું, સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ, કેટ ઓઈલ વગેરેનો ઉપયોગ કરી રોડ અક્સ્માત ઘટાડવા સાથે રોડ એન્જિનીયરીંગને લગત

પગલાં લેવા બાબતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અમરેલીની વિવિધ શાળાઓમાં માર્ગ સલામતીને લઈને જનજાગૃતિ સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ઓગસ્ટ મહિનામાં માર્ગ સલામતી માસ અંતર્ગત જનજાગૃતિ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ ઉત્પાદકો તરફથી કાયમી રિફલેક્ટર લગાડવામાં નથી આવતા તેવા ખેતીવાડીમાં વપરાતા ટ્રેલરો પર

રેડિયમ રિફલેક્ટર લગાડેલા ન હોય તેવા વાહનોના ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. કાયમી રિફલેક્ટર ન હોય અને રેડિયમ રિફલેક્ટર પણ લગાડેલા ન હોય તેવા વાહનોના લીધે અક્સ્માત ન સર્જાય અને તેના લીધે વાહનના કોઈ પણ ચાલકે જીવ ગુમાવવો ન પડે તે માટે તકેદારીના ભાગરૂપે આ જનજાગૃતિ જરૂરી છે. આર.ટી.ઓ દ્વારા પ્રતિમાસ નિઃશુલ્ક રેડીયમ રિફલેક્ટર ખેતીવાડીમાં વપરાતા વાહનોમાં લગાડવામાં આવે છે તેમ છતાં જે

વાહનો આવ્યા રિફલેક્ટર વગરના છે અથવા તો રિફલેક્ટર નથી લગાડતા તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે. નેશનલ હાઈવે પર ડિવાઈડર તોડનાર ઈસમો સામે કાનૂની કાર્યવાહી કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીશ્રીઓને કલેક્ટરશ્રીએ તાકીદ કરી હતી. જે જગ્યાએ વીડિયો ડિવાઈડર તોડી નાખનાર ઈસમો મળી આવે તેમના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર દબાણો અંગેની

કલેક્ટરશ્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જે માર્ગ પર દબાણ હોય તેને આગામી સમયમાં દૂર કરવા માટે જરૂરી આયોજન કરવા માટે જણાવાયું હતું. જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ રોડ રસ્તા ઉપર વૃક્ષોનું ટ્રીમીંગ, રમ્બલ સ્પીડ બ્રેકર સહિતની બાબતોને લઈને સંબંધિત અધિકારીશ્રીઓને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી હતી. વાહન ચાલકોએ સલામતી માટે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો, અતિશય ઝડપે વાહન ચલાવવું નહીં વગેરે

બાબતોને લઈને કાળજી રાખવી હિતાવહ છે. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલા બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી સંજય ખરાત, નિવાસી અધિક કલેક્ટરશ્રી એ.એ. ડોડિયા પ્રાંત અધિકારીશ્રી અમરેલી-કુકાવાવ જાડેજા, આર.ટી.ઓ શ્રી બી.એસ. કલસરિયા, સહિત સંબંધિત વિવિધ કચેરીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન આર.ટી.ઓ ઈન્સ્પેક્ટર શ્રી એમ.વી. શાહે કર્યું હતું.

THIS IS A PUBLIC ANNOUNCEMENT FOR INFORMATION PURPOSES ONLY. THIS IS NOT A PROSPECTUS ANNOUNCEMENT AND DOES NOT CONSTITUTE AN INVITATION OR OFFER TO ACQUIRE, PURCHASE OR SUBSCRIBE TO SECURITIES. NOT FOR RELEASE, PUBLICATION OR DISTRIBUTION DIRECTLY OR INDIRECTLY OUTSIDE INDIA. Initial Public Offer of equity shares on the main board of BSE Limited ("BSE") and National Stock Exchange of India Limited ("NSE", and together with BSE, the "Stock Exchanges") in compliance with Chapter II of the Securities and Exchange Board of India (Issue of Capital and Disclosure Requirements) Regulations, 2018, as amended ("SEBI ICDR Regulations").



(Please scan this QR Code to view the Red Herring Prospectus and the Abridged Prospectus)

## ASSET RECONSTRUCTION COMPANY (INDIA) LIMITED (TO BE LISTED ON THE MAIN BOARD OF BSE AND NSE)

Our Company was originally incorporated as "Asset Reconstruction Company (India) Limited " as a public limited company under the Companies Act, 1956 through certificate of incorporation dated February 11, 2002, issued by the Registrar of Companies, Maharashtra at Mumbai, received a certificate of commencement of business from the Registrar of Companies, Maharashtra at Mumbai, on May 7, 2003 and received the certificate of registration from the Reserve Bank of India to commence business on August 29, 2003. For details of the changes in registered office of our Company, see "History and Certain Corporate Matters – Changes in registered office of our Company" on page 210 of the red herring prospectus dated September 1, 2026 ("RHP" or "Red Herring Prospectus") filed with the Registrar of Companies, Mumbai - I at Mumbai ("RoC") and read with Addendum to RHP dated September 7, 2026 ("Addendum").

Corporate Identity Number: U65999MH2002PLC134884

Registered and Corporate Office: The Ruby, 10<sup>th</sup> Floor, 29 Senapati Bapat Marg, Dadar (West), Mumbai – 400 028, Maharashtra, India; Tel: +91 22-66581300; Contact Person: Ameet Ashok Kela, Company Secretary and Compliance Officer, Head CSR; E-mail: cs@arcil.co.in; Website: www.arcil.co.in

### OUR PROMOTERS: AVENUE INDIA RESURGENCE PTE. LTD. AND STATE BANK OF INDIA

INITIAL PUBLIC OFFERING OF UP TO 52,731,946 EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10 EACH ("EQUITY SHARES") OF ASSET RECONSTRUCTION COMPANY (INDIA) LIMITED ("COMPANY" OR THE "ISSUER") FOR CASH AT A PRICE OF ₹ [●] PER EQUITY SHARE (INCLUDING A SHARE PREMIUM OF ₹ [●] PER EQUITY SHARE) ("OFFER PRICE") AGGREGATING UP TO ₹ [●] MILLION (THE "OFFER"). THE OFFER COMPRISES OF AN OFFER FOR SALE OF UP TO 52,731,946 EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10 EACH (THE "OFFERED SHARES") AGGREGATING UP TO ₹ [●] MILLION (THE "OFFER FOR SALE"), COMPRISING UP TO 24,823,910 EQUITY SHARES AGGREGATING UP TO ₹ [●] MILLION BY AVENUE INDIA RESURGENCE PTE. LTD., UP TO 10,963,062 EQUITY SHARES AGGREGATING UP TO ₹ [●] MILLION BY STATE BANK OF INDIA (TOGETHER REFERRED TO AS "PROMOTER SELLING SHAREHOLDERS"), UP TO 16,244,858 EQUITY SHARES AGGREGATING UP TO ₹ [●] MILLION BY LATHE INVESTMENT PTE. LTD. ("INVESTOR SELLING SHAREHOLDER") AND UP TO 700,116 EQUITY SHARES AGGREGATING UP TO ₹ [●] MILLION BY THE FEDERAL BANK LIMITED ("OTHER SELLING SHAREHOLDER", AND ALONG WITH THE PROMOTER SELLING SHAREHOLDERS AND INVESTOR SELLING SHAREHOLDER, THE "SELLING SHAREHOLDERS"). THE OFFER SHALL CONSTITUTE [●] % OF THE POST-OFFER PAID-UP EQUITY SHARE CAPITAL OF OUR COMPANY.

| DETAILS OF THE SELLING SHAREHOLDERS, OFFER FOR SALE AND THE WEIGHTED AVERAGE COST OF ACQUISITION |                                  |                                                                                          |                                                               |
|--------------------------------------------------------------------------------------------------|----------------------------------|------------------------------------------------------------------------------------------|---------------------------------------------------------------|
| Name of Selling Shareholder                                                                      | Type of the Selling Shareholders | Number of Equity Shares of face value of ₹10 each being offered/ amount                  | Weighted Average Cost of Acquisition per Equity Share (in ₹)* |
| Avenue India Resurgence Pte. Ltd.                                                                | Promoter Selling Shareholder     | Up to 24,823,910 Equity Shares of face value of ₹10 each aggregating up to ₹ [●] million | 55.62                                                         |
| State Bank of India                                                                              | Promoter Selling Shareholder     | Up to 10,963,062 Equity Shares of face value of ₹10 each aggregating up to ₹ [●] million | 36.76                                                         |
| Lathe Investment Pte. Ltd.                                                                       | Investor Selling Shareholder     | Up to 16,244,858 Equity Shares of face value of ₹10 each aggregating up to ₹ [●] million | 84.00                                                         |
| The Federal Bank Limited                                                                         | Other Selling Shareholder        | Up to 700,116 Equity Shares of face value of ₹10 each aggregating up to ₹ [●] million    | 35.43                                                         |

\*As certified by J. Kala & Associates, Chartered Accountants (FRN: 118769W) by way of their certificate dated September 7, 2026

PRICE BAND: ₹ 132 TO ₹ 139 PER EQUITY SHARE OF FACE VALUE OF ₹ 10 EACH.

THE FLOOR PRICE AND THE CAP PRICE ARE 13.20 TIMES AND 13.90 TIMES THE FACE VALUE OF THE EQUITY SHARES, RESPECTIVELY.

THE PRICE TO EARNINGS RATIO ("P/E") BASED ON BASIC AND DILUTED EPS FOR FISCAL 2026 ON CONSOLIDATED AND STANDALONE BASIS FOR OUR COMPANY AT THE LOWER END OF THE PRICE BAND (I.E. FLOOR PRICE) IS 12.20 TIMES AND 12.85 TIMES RESPECTIVELY AND AT THE UPPER END OF THE PRICE BAND (I.E. CAP PRICE) IS 10.52 TIMES AND 11.08 TIMES RESPECTIVELY

BIDS CAN BE MADE FOR A MINIMUM OF 107 EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10 EACH AND IN MULTIPLES OF 107 EQUITY SHARES OF FACE VALUE OF ₹10 EACH THEREAFTER.

WEIGHTED AVERAGE RETURN ON NET WORTH FOR LAST THREE FISCAL YEARS ON CONSOLIDATED AND STANDALONE IS 12.94% AND 13.67%.

The details of the Offer for Sale and the post Offer market capitalization of the Company, each at the Floor Price and the Cap Price, are given below:

| Particulars                                                    | At Floor Price of ₹132                                |                             | At Cap Price of ₹139                                 |                             |
|----------------------------------------------------------------|-------------------------------------------------------|-----------------------------|------------------------------------------------------|-----------------------------|
|                                                                | Up to No. of Equity Shares of face value of ₹ 10 each | Up to Amount (₹ in million) | Up to No. of Equity Shares of face value of ₹10 each | Up to Amount (₹ in million) |
| Offer for Sale                                                 | 52,731,946                                            | 6,960.62                    | 52,731,946                                           | 7,329.74                    |
| Post-Offer market capitalization of the Company (₹ in million) | 42,886.42                                             |                             | 45,160.70                                            |                             |

| BID/OFFER PERIOD | BID/OFFER OPENS TODAY                              |
|------------------|----------------------------------------------------|
|                  | BID/OFFER CLOSSES ON : FRIDAY, SEPTEMBER 11, 2026^ |

^UPI mandate end time and date shall be at 5:00 pm on the Bid/Offer Closing Date

Our Company is an asset reconstruction company ("ARC") operating across India and are engaged in the business of acquiring stressed assets from banks and financial institutions and implementing resolution strategies through restructuring, enforcement of rights on underlying securities and settlement aimed at maximizing recovery and optimizing the value of such stressed assets in order to generate revenue streams.

THE OFFER IS BEING MADE THROUGH THE BOOK BUILDING PROCESS IN ACCORDANCE WITH REGULATION 6(1) OF THE SEBI ICDR REGULATIONS.

THE EQUITY SHARES OF OUR COMPANY WILL GET LISTED ON THE MAIN BOARD OF THE STOCK EXCHANGES. NSE SHALL BE THE DESIGNATED STOCK EXCHANGE.

QIB PORTION: NOT MORE THAN 50% OF THE OFFER | NON-INSTITUTIONAL PORTION: NOT LESS THAN 15% OF THE OFFER | RETAIL PORTION: NOT LESS THAN 35% OF THE OFFER

IN MAKING AN INVESTMENT DECISION, POTENTIAL INVESTORS MUST ONLY RELY ON THE INFORMATION INCLUDED IN THE RED HERRING PROSPECTUS AND THE TERMS OF THE OFFER, INCLUDING THE RISKS INVOLVED AND NOT RELY ON ANY OTHER EXTERNAL SOURCES OF INFORMATION ABOUT THE OFFER AVAILABLE IN ANY MANNER. IN RELATION TO PRICE BAND, POTENTIAL INVESTORS SHOULD ONLY REFER TO THIS PRICE BAND ADVERTISEMENT FOR THE OFFER AND SHOULD NOT RELY ON ANY MEDIA ARTICLES / REPORTS IN RELATION TO THE VALUATION OF OUR COMPANY AS THESE ARE NOT ENDORSED, PUBLISHED OR CONFIRMED EITHER BY THE COMPANY OR THE BOOK RUNNING LEAD MANAGERS TO THE OFFER ("BRLMs").

IN ACCORDANCE WITH THE RECOMMENDATION OF THE COMMITTEE OF INDEPENDENT DIRECTORS OF OUR COMPANY, PURSUANT TO THEIR RESOLUTION DATED SEPTEMBER 2, 2026, THE ABOVE PROVIDED PRICE BAND IS JUSTIFIED BASED ON QUANTITATIVE FACTORS/ KEY PERFORMANCE INDICATORS ("KPI") DISCLOSED IN THE "BASIS FOR OFFER PRICE" SECTION ON PAGE 105 OF THE RHP AND READ WITH ADDENDUM V/S A-VIS THE WEIGHTED AVERAGE COST OF ACQUISITION ("WACA") OF PRIMARY AND SECONDARY TRANSACTION(S), AS APPLICABLE, DISCLOSED IN "BASIS FOR OFFER PRICE" SECTION ON PAGE 105 OF THE RHP AND READ WITH ADDENDUM.

### RISKS TO INVESTORS

For details refer to section titled "Risk Factors" beginning on page 24 of the RHP

**1. Dependence on value and composition AUM:** A significant portion of our revenue is derived from management fees/ trusteeship fees charged by us for managing stressed asset portfolios, and from our investments into the stressed asset portfolios that we manage. The table below sets forth our revenue earned from fee income (which also includes our collection fees) and investment income for the years indicated on a consolidated and standalone basis:

| Particulars (on a consolidated basis)                                                                        | Fiscal 2026        |                                                | Fiscal 2025        |                                                | Fiscal 2024        |                                                |
|--------------------------------------------------------------------------------------------------------------|--------------------|------------------------------------------------|--------------------|------------------------------------------------|--------------------|------------------------------------------------|
|                                                                                                              | Amount (₹ million) | As a percentage of revenue from operations (%) | Amount (₹ million) | As a percentage of revenue from operations (%) | Amount (₹ million) | As a percentage of revenue from operations (%) |
| Fee income (corresponding to fee and other income in the Restated Consolidated Financial Information)        | 2,355.49           | 53.47%                                         | 1,275.96           | 39.09%                                         | 1,466.75           | 49.46%                                         |
| Investment income (corresponds to other operating income in the Restated Consolidated Financial Information) | 2,050.13           | 46.53%                                         | 1,988.02           | 60.91%                                         | 1,498.96           | 50.54%                                         |
| <b>Total</b>                                                                                                 | <b>4,405.62</b>    | <b>100.00%</b>                                 | <b>3,263.96</b>    | <b>100.00%</b>                                 | <b>2,965.71</b>    | <b>100.00%</b>                                 |

| Particulars (on a standalone basis)                                                                        | Fiscal 2026        |                                                | Fiscal 2025        |                                                | Fiscal 2024        |                                                |
|------------------------------------------------------------------------------------------------------------|--------------------|------------------------------------------------|--------------------|------------------------------------------------|--------------------|------------------------------------------------|
|                                                                                                            | Amount (₹ million) | As a percentage of revenue from operations (%) | Amount (₹ million) | As a percentage of revenue from operations (%) | Amount (₹ million) | As a percentage of revenue from operations (%) |
| Fee income (corresponding to fee and other income in the Restated Standalone Financial Information)        | 2,800.95           | 59.42%                                         | 1,719.08           | 47.21%                                         | 1,788.71           | 68.48%                                         |
| Investment income (corresponds to other operating income in the Restated Standalone Financial Information) | 1,913.12           | 40.58%                                         | 1,922.53           | 52.79%                                         | 823.38             | 31.52%                                         |
| <b>Total</b>                                                                                               | <b>4,714.07</b>    | <b>100.00%</b>                                 | <b>3,641.61</b>    | <b>100.00%</b>                                 | <b>2,612.09</b>    | <b>100.00%</b>                                 |

For details of the ageing of our AUM as on March 31, 2026, please refer risk factor 1 on page 24 of the RHP

The following table sets forth details of our AUM across our business verticals as of the dates indicated:

| Particulars                  | March 31, 2026     |                | March 31, 2025     |                | March 31, 2024     |                |
|------------------------------|--------------------|----------------|--------------------|----------------|--------------------|----------------|
|                              | Amount (₹ million) | (% of AUM)     | Amount (₹ million) | (% of AUM)     | Amount (₹ million) | (% of AUM)     |
| Corporate loans              | 1,38,527.61        | 68.75%         | 127,200.05         | 75.48%         | 119,564.02         | 78.51%         |
| SME and Other loans          | 15,524.65          | 7.70%          | 13,846.85          | 8.22%          | 13,313.33          | 8.74%          |
| Retail loans                 | 47,447.61          | 23.55%         | 27,478.80          | 16.31%         | 19,422.96          | 12.75%         |
| <b>Total AUM</b>             | <b>201,499.87</b>  | <b>100.00%</b> | <b>168,525.70</b>  | <b>100.00%</b> | <b>152,300.31</b>  | <b>100.00%</b> |
| <b>Company's Investment*</b> | <b>44,085.89</b>   | <b>21.88%</b>  | <b>32,983.01</b>   | <b>19.57%</b>  | <b>27,633.87</b>   | <b>18.14%</b>  |

\*Company's investment (%) = Company's holding of SRs in a particular trust / total outstanding SRs of a particular trust\*100.

Any decrease in our AUM may cause a decline in our fees and therefore our revenue from operations, and consequently, our profit. For further details, please refer to risk factor 1 on page 24 of the RHP

**2. Non-compliance with RBI's observations:** In the last three Fiscals, RBI has conducted two off-site assessments and inspections for supervisory evaluation and one select scope inspection under the SARFAESI Act. Subsequent to the first and second off-site assessment and inspection, the RBI issued the inspection and risk assessment report on February 15, 2024 (the "IRAR") and August 6, 2025, respectively, with major supervisory concerns including (i) non-compliance with the provisions of the Regulatory Framework for Asset Reconstruction Companies dated October 11, 2022; (ii) deficiency in succession planning policy; (iii) deficiency/ absence of certain policies pertaining to acquisition, resolution, expected credit loss, dividend distribution, KYC, outsourcing and business continuity plan Pursuant to the RBI's second off-site assessment and inspection, the RBI issued the inspection and risk assessment report on August 6, 2025, with major supervisory concerns including deficiency in minutes of the meetings of the Board and committees of the Board.

Subsequently, in connection with the IRAR, we received follow-on queries from RBI dated June 12, 2025, setting out follow-on observations including (i) requiring us to conduct root cause analysis of all the cases wherein the settlement was approved below the realizable sale value of securities; (ii) submission of the status of documents collected from the seller institutions where there was a delay in collection; (iii) submission of the status of automation of corporate business and financial statements along with relevant approvals and timelines for completion and (iv) submission of root cause analysis of deviations from the acquisition policy on account of approval sought from the executive committee instead of the Board for acquiring 8 out of 30 assets during Fiscal 2023. (v) submission of compliance with respect to periodic risk categorization and KYC updation of customers/borrowers; and (vi) inclusion of the discount rate for calculating net present value of settlement in the resolution policy.

Our Company through its letter dated June 24, 2025 responded to RBI and provided its action/ compliance on RBI's follow-on observations. Subsequent to the RBI's audit for Fiscal 2025, we received a communication from the RBI dated April 15, 2026 setting out certain supervisory observations, including (i) a variance in the reporting of risk-weighted assets, with risk-weighted assets reported by the Company at ₹2,830.18 crore as against the RBI's assessment of ₹2,838.52 crore; and (ii) 0.01% of the Company's shareholding, comprising 32,476 equity shares held by an ex-employee of the Company, remaining in physical form as of March 31, 2025. While the RBI has not levied any penalty or taken any enforcement action for the above non-compliances, or in the preceding three Fiscals, and we have provided necessary clarifications or undertaken to ensure compliance with the above observations, we cannot assure that

Continued on next page...

...continued from previous page.

such steps will be satisfactory and that the RBI will not have further observations in the future or will not impose any penalties for non-compliances. For further details, please refer to risk factor 2 on page 26 of the RHP.

**3. Competitive Bidding Process:** We bid for stressed assets through a competitive bidding process, including the Swiss challenge and anchor process, where stressed assets are assigned upon satisfaction of the prescribed qualifying criteria. The table below provides details of the total number of bids in value terms in which we participated and won in the relevant Fiscals:

| Particulars                   | Fiscal 2026 | Fiscal 2025 | Fiscal 2024 |
|-------------------------------|-------------|-------------|-------------|
| Bids participated (₹ million) | 75,150.77   | 57,512.40   | 56,801.11   |
| Bids won (₹ million)          | 59,588.00   | 39,758.71   | 20,689.82   |
| Percentage of Bids won (%)    | 79.29%      | 69.13%      | 36.43%      |

If we are unable to acquire stressed assets through such bidding process, in a timely manner, or at all, it could adversely affect our business prospects, cash flows and results of operations. The table below sets forth details of stressed assets acquired from top five banks and financial institutions (in terms of assets acquired) in Fiscals 2026, 2025 and 2024:

| Particulars                                 | Fiscal 2026        |                                     | Fiscal 2025        |                                     | Fiscal 2024        |                                     |
|---------------------------------------------|--------------------|-------------------------------------|--------------------|-------------------------------------|--------------------|-------------------------------------|
|                                             | Amount (₹ million) | % of Total acquisition for the year | Amount (₹ million) | % of Total acquisition for the year | Amount (₹ million) | % of Total acquisition for the year |
| Top 5 selling banks/ Financial institutions | 40,024.24          | 67.17%                              | 27,999.88          | 70.42%                              | 16,390.02          | 79.22%                              |

**4. Inability to recover outstanding amounts from the stressed assets:** The income and cash flow we generate from our stressed assets depends on various factors, including our ability to manage our stressed assets effectively. We utilize different resolution strategies targeted at maximizing the potential of recovery from the distressed assets we acquire.

The table below sets out details in relation to the collections and redemptions of SRs by the trusts managed by us for the years indicated:

| Particulars                      | Fiscal 2026<br>(₹ in million) | Fiscal 2025<br>(₹ in million) | Fiscal 2024<br>(₹ in million) |
|----------------------------------|-------------------------------|-------------------------------|-------------------------------|
| Opening AUM                      | 168,525.70                    | 152,300.31                    | 162,234.83                    |
| Additions to AUM during the year | 59,588.00                     | 39,758.71                     | 20,689.82                     |
| Redemption                       | 26,381.17                     | 22,233.11                     | 29,534.71                     |
| Write-off                        | 232.65                        | 1,300.22                      | 1,089.63                      |
| Closing AUM                      | 201,499.87                    | 168,525.70                    | 152,300.31                    |
| Collections                      | 34,843.91                     | 38,826.55                     | 36,781.46                     |
| Redemption % on opening AUM (%)  | 15.65%                        | 14.60%                        | 18.20%                        |

The table below set out details of SRs issued, outstanding SR value, gross recovery, recovery during the year and gross recovery as a percentage of acquisition for the last three Fiscals, for our top 10 portfolios of stressed assets in each Fiscal:

| Particulars | SRs issued<br>(in ₹ million) | Outstanding SR value<br>(in ₹ million) | Gross Recovery (in ₹ million) | Recovery (in ₹ million) | Gross Recovery as a Percentage of Acquisition (%) |
|-------------|------------------------------|----------------------------------------|-------------------------------|-------------------------|---------------------------------------------------|
| Fiscal 2026 | 106,133.46                   | 77,430.30                              | 37,351.45                     | 5,042.54                | 35.19%                                            |
| Fiscal 2025 | 83,107.98                    | 60,663.59                              | 32,308.91                     | 16,939.08               | 38.88%                                            |
| Fiscal 2024 | 72,051.69                    | 58,163.71                              | 19,234.37                     | 9,316.16                | 26.70%                                            |

We are required to obtain recovery ratings from SEBI registered rating agencies on the SRs issued by trusts which are managed by us. The recovery ratings indicate the extent of recovery expected within the timeframe (on a present value basis) stipulated in the RBI guidelines (five years, extendable to eight). Further, the valuation of an ARC's investments in SRs assets and its management fees are linked to the recovery ratings of the SRs. Set forth below are details of the recovery ratings assigned to the rated SRs issued by the trusts managed by us, as of the dates indicated:

| Particulars                             | Percentage of outstanding rated AUM |                      |                      |
|-----------------------------------------|-------------------------------------|----------------------|----------------------|
|                                         | As of March 31, 2026                | As of March 31, 2025 | As of March 31, 2024 |
| RR1+ <sup>(1)</sup> /RR1 <sup>(2)</sup> | 32.83%                              | 34.32%               | 34.33%               |
| RR2 <sup>(3)</sup>                      | 54.75%                              | 44.95%               | 45.30%               |
| RR3 <sup>(4)</sup>                      | 10.49%                              | 17.65%               | 15.81%               |
| RR4/ RR5 <sup>(5)</sup>                 | 1.93%                               | 3.08%                | 4.56%                |
| Total                                   | 100.00%                             | 100.00%              | 100.00%              |
| Unrated <sup>(6)</sup>                  | Rating is under process             |                      |                      |

(1) RR1+: Indicates 150% and above recovery of outstanding face value of SRs.  
(2) RR1: Indicates 100% to 150% recovery of outstanding face value of SRs.  
(3) RR2: Indicates 75% to 100% recovery of outstanding face value of SRs.  
(4) RR3: Indicates 50% to 75% recovery of outstanding face value of SRs.  
(5) RR4: Indicates 25% to 50% recovery of outstanding face value of SRs; RR5: Indicates 0% to 25% recovery of outstanding face value of SRs.  
(6) An unrated portfolio is on account of new acquisitions which are in the process of being rated.  
Note: For SRs over 8 years, the ratings are compulsorily withdrawn based on guidelines prescribed by RBI, except in certain exceptional circumstances, as prescribed by the RBI. In accordance with the guidelines prescribed by RBI, the above table includes certain SRs, where the SRs issued by the trusts managed by us are over 8 years, but where the RBI guidelines allow for such SRs to be rated.

While as of March 31, 2026, March 31, 2025 and March 31, 2024, 98.07%, 96.92% and 95.44%, respectively of the rated SRs issued by the trusts managed by us were rated RR3 and above, if the percentage of SRs rated RR4/RR5 were to increase, it will impact the quality of our AUM and have an adverse effect on our business, results of operations, financial condition and cash flows.

**5. Dependence on corporate loans business vertical:** A significant portion of our stressed assets are under our corporate loans business vertical (representing 68.75%, 75.48% and 78.51% of our AUM as of March 31, 2026, March 31, 2025, March 31, 2024, respectively). The following table sets forth details of our corporate loan AUM as of the dates indicated:

| Particulars     | March 31, 2026     |            | March 31, 2025     |            | March 31, 2024     |            |
|-----------------|--------------------|------------|--------------------|------------|--------------------|------------|
|                 | Amount (₹ million) | (% of AUM) | Amount (₹ million) | (% of AUM) | Amount (₹ million) | (% of AUM) |
| Corporate loans | 138,527.61         | 68.75%     | 127,200.05         | 75.48%     | 119,564.02         | 78.51%     |
| Total AUM       | 201,499.87         | 100.00%    | 168,525.70         | 100.00%    | 152,300.31         | 100.00%    |

Set out below are details of our top 10 corporate portfolios for Fiscals 2026, 2025 and 2024

| Particulars                 | Fiscal 2026         |            | Fiscal 2025        |            | Fiscal 2024        |            |
|-----------------------------|---------------------|------------|--------------------|------------|--------------------|------------|
|                             | Amount (₹ million)* | (% of AUM) | Amount (₹ million) | (% of AUM) | Amount (₹ million) | (% of AUM) |
| Top 10 corporate portfolios | 68,967.97           | 22.09%     | 51,274.47          | 30.43%     | 51,388.40          | 33.74%     |

\*The amounts are measured at outstanding book value.

**6. Inability to make accurate stressed asset acquisition decisions:** In determining the price for the acquisition of stressed assets, we have to consider various factors, including our expectation of recovery, competition, collateral values, sectors in which the corporate borrowers operate for our corporate loan portfolio and profiles of the borrowers which constitute the pool of stressed assets. We have implemented a comprehensive credit assessment and risk management framework to evaluate potential acquisitions, determine the recovery potential of the assets and manage risks inherent in our operations. Our diligence to evaluate a portfolio includes legal due diligence to assess the enforceability of the security, conducting site visits to understand the value and marketability of the security and diligence on borrowers. Our IT systems collect data from various government databases, which enables us to conduct verification checks on borrowers. For details, see "Our Business- Our Strengths- Expertise in Acquiring Stressed Assets with Increasing Investment in SRs" on page 176 of the RHP.

**7. Significantly rely on information technology systems:** Our ability to operate and remain competitive depends in part on our ability to maintain and upgrade our information technology systems and infrastructure on a timely and cost-effective basis. Our financial, accounting and other data processing systems, management information systems and our corporate website may fail to operate adequately or become

disabled as a result of events beyond our control, including a disruption of electrical or communications services. Our systemic and operational controls may not be adequate to prevent adverse impact from frauds, errors, hacking and system failures. Further, applications and interfaces, may be open to being hacked or compromised by third parties. The intention of these attacks could be to steal our data or information, or to shut down our systems and only release them for a fee.

**8. Stricter regulations and guidelines issued by regulatory authorities in India, including the RBI, which may increase our compliance costs, divert the attention of our management and subject us to penalties.:** As an asset reconstruction company, we are required to comply with various laws and regulatory requirements including the SARFAESI Act, the IBC and RBI Master Directions under which we are required to comply with certain compliances and conditions. To carry out the business of securitization or asset reconstruction, we are mandated to obtain a certificate of registration from the RBI under SARFAESI Act, 2002.

**9. Risk related to Seasonality :** Our business is subject to seasonality as we generally see a surge in activity during the fourth quarter as banks and financial institutions sell stressed assets on their books before the end of the financial year to improve asset quality and meet regulatory provisioning norms. The second quarter also sees higher transaction volumes and asset acquisition due to banks and financial institutions conducting half-yearly financial assessments giving rise to a sale in stressed assets. Economic downturns lead to higher defaults, and increased stressed asset acquisitions whereas economic recovery improves corporate balance sheets and retail financial health reduces the formation of new stressed assets. For instance, the Indian economy has witnessed a notable improvement in the financial health of companies over the past few fiscal years. (Source: CRISIL Report) This upward trend is attributed to the concerted efforts of Indian banks to rectify their balance sheets, coupled with enhanced collection efficiency. (Source: CRISIL Report) The gross non-performing assets levels of large borrowers (with aggregate exposure of ₹ 50 million and above to any single SCB) in SCBs has significantly declined from 14.3% in Fiscal 2019 to 1.2% in Fiscal 2026. (Source: CRISIL Report) Set out below is data in connection with GNPA and write-offs by SCBs:

| Particulars                                               | Fiscal 2019 | Fiscal 2020 | Fiscal 2021 | Fiscal 2022 | Fiscal 2023 | Fiscal 2024 | Fiscal 2025 |
|-----------------------------------------------------------|-------------|-------------|-------------|-------------|-------------|-------------|-------------|
| GNPA of SCBs                                              | 9,336.1     | 8,960.8     | 8,350.5     | 7,424.0     | 5,718.5     | 4,807.0     | 4,316.3     |
| 1) Change in NPA -growth/(fall) compared to previous year | (1,025.8)   | (375.3)     | (610.3)     | (926.5)     | (1,705.5)   | (911.5)     | (490.7)     |
| 2) Annual Write-offs of SCBs                              | 2,362.7     | 2,341.7     | 2,027.8     | 1,749.7     | 2,091.4     | 1,702.7     | 1,372.6     |
| Changes in GNPA + write-offs (1+2)                        | 1,336.9     | 1,966.4     | 1,417.5     | 823.1       | 386.0       | 791.2       | 881.9       |

Note: Numbers are rounded off to nearest billion up to one decimal point. For Fiscal 2024, annual write-offs have been directly sourced from the RBI database but for Fiscal 2025, annual write off has been calculated by applying write-off to gross NPA ratio on total gross NPAs, since annual write off data was directly not available.

Source: RBI, CRISIL Intelligence.

**10. Risk related to Restated Consolidated Financial Information:** While preparing our Restated Consolidated Financial Information, we consolidate those trusts in which our outstanding investment in security receipts is more than 25% as subsidiaries in accordance with Ind AS 110 and our accounting policies. We consolidate all line items in relation to such trusts identified as subsidiaries including investment in security receipts, management fee recoverable from trusts, and other operating income, in accordance with applicable accounting standards. Trusts in which our outstanding investments in security receipts is between 20% and 25% are considered as associates in our Restated Consolidated Financial Information in accordance with Ind AS 110 and our accounting policies. For such trusts, we consolidate only the share of profit/loss of the associate in our Restated Consolidated Financial Information, in accordance with applicable accounting standards. The assets and liabilities of the trusts are legally distinct from our Company's assets and liabilities and are held for the benefit of the SR Holders. The consolidation of the results of the trusts with those of our Company in our Restated Consolidated Financial Information may impact our financial metrics.

11. Our Company will not receive any proceeds from the Offer. The Selling Shareholders shall be entitled to proceeds from the Offer for Sale.
12. The Price/Earnings ratio based on Basic and Diluted EPS for Fiscal 2026 on consolidated and standalone basis for our company at the lower end of the price band (i.e. Floor Price) is 12.20 times and 12.85 times respectively and at the upper end of the price band (i.e. Cap Price) is 10.52 times and 11.08 times respectively. There are no listed companies which are comparable in size to the Company in India or globally in the same industry.
13. Highest average cost of acquisition of Equity Shares for the Selling Shareholders in the Offer is ₹ 84, and Offer Price at the upper end of the price band is ₹ 139 per Equity Share.
14. The weighted average return on net worth for last three fiscal years on consolidated and standalone is 12.94% and 13.67%.
15. **Details of the weighted average cost of acquisition of specified securities held of our Promoters (also the Promoter Selling Shareholders), Investor Selling Shareholder and the Other Selling Shareholder as on the date of the Red Herring Prospectus and as on one year prior to the date of the Red Herring Prospectus:**

| Period                              | No. of Equity Shares of face value ₹10 each as on date of the Red Herring Prospectus | Weighted average cost of acquisition per Equity Share as on the date of the Red Herring Prospectus (in ₹)* | Weighted average cost of acquisition per Equity Share one year prior to the date of the Red Herring Prospectus* (₹) |
|-------------------------------------|--------------------------------------------------------------------------------------|------------------------------------------------------------------------------------------------------------|---------------------------------------------------------------------------------------------------------------------|
| <b>Promoters</b>                    |                                                                                      |                                                                                                            |                                                                                                                     |
| Avenue India Resurgence Pte. Ltd**  | 22,26,09,431                                                                         | 55.62                                                                                                      | Nil                                                                                                                 |
| State Bank of India**               | 64,816,980                                                                           | 36.76                                                                                                      | Nil                                                                                                                 |
| <b>Investor Selling Shareholder</b> |                                                                                      |                                                                                                            |                                                                                                                     |
| Lathe Investments Pte Ltd.          | 16,244,858                                                                           | 84.00                                                                                                      | Nil                                                                                                                 |
| <b>Other Selling Shareholder</b>    |                                                                                      |                                                                                                            |                                                                                                                     |
| The Federal Bank Limited            | 4,139,300                                                                            | 35.43                                                                                                      | Nil                                                                                                                 |

\*As certified by J. Kala & Associates, Chartered Accountants (FRN: 118769W), by way of their certificate dated September 7, 2026.

\*\*Also the Promoter Selling Shareholder

**16. Details of the weighted average cost of acquisition of all shares transacted in the last one year, eighteen months and three years preceding the date of the Red Herring Prospectus is as follows:**

| Period                                                                | Weighted average cost of acquisition per Equity Share (in ₹)* | Upper end of the price band (₹139) is 'X' times the weighted average cost of acquisition | Range of acquisition price per Equity Share: lowest price – highest price (in ₹) |
|-----------------------------------------------------------------------|---------------------------------------------------------------|------------------------------------------------------------------------------------------|----------------------------------------------------------------------------------|
| Last one year preceding the date of the Red Herring Prospectus        | 139.00                                                        | 1.00 times                                                                               | Nil - 139.00                                                                     |
| Last eighteen months preceding the date of the Red Herring Prospectus | 139.00                                                        | 1.00 times                                                                               | Nil - 139.00                                                                     |
| Last three years preceding the date of the Red Herring Prospectus     | 139.00                                                        | 1.00 times                                                                               | Nil - 139.00                                                                     |

\*As certified by J. Kala & Associates, Chartered Accountants (FRN: 118769W), by way of their certificate dated September 7, 2026.

**17. The three BRLMs associated with the Offer have handled 90 public issues in the current financial year and preceding two financial years, out of which 27 issues closed below the offer price on the listing date**

| Name of the BRLMs                                                                  | Total Public Issues | Issues closed below the issue price on listing date |
|------------------------------------------------------------------------------------|---------------------|-----------------------------------------------------|
| IIFL Capital Services Limited<br><i>formerly known as IIFL Securities Limited)</i> | 30                  | 10                                                  |
| IDBI Capital Markets & Securities Limited                                          | 6                   | 1                                                   |
| JM Financial Limited                                                               | 31                  | 10                                                  |
| Common Issues of above BRLMs*                                                      | 23                  | 6                                                   |
| Total                                                                              | 90                  | 27                                                  |

\*Issue handled where there are common BRLMs

९ द. ०६-०६-२०२५, बुधवार

सीराफ़ सासपास

...continued from previous page.

ADDITIONAL INFORMATION FOR INVESTORS

- 1) The Company has not undertaken any pre-IPO placement.
- 2) Except as stated below, there have not been any transactions of shares aggregating up to 1% or more of the paid-up equity share capital of the Company by Promoter(s) and Promoter Group(s) from the DRHP filing till date.
- One of our Promoter Selling Shareholder, Avenue India Resurgence Pte. Ltd., has entered into share purchase agreements, each dated September 4, 2026, with Whiteoak Capital India Opportunities Fund and Dymon Asia Multi-Strategy Investment (Singapore) Pte. Ltd. transferring an aggregate of 3,956,834 Equity Shares of face value ₹10 each on September 7, 2026, representing 1.21% of the pre-Offer paid-up Equity Share capital of our Company (the "Sale Shares"), at a price of ₹139.00 per Equity Share, as set out below:

| S. No. | Nature of Transaction | Name of Transferor                | Name of the Transferee                                     | Date of transfer  | Whether transferee is connected, in any manner, with the Company, the Promoters, members of the Promoter Group, the Directors, the Key Managerial Personnel, the Subsidiaries, and group companies and their respective directors and key managerial personnel*% | Number of Equity Shares of face value of ₹10 each transferred | Percentage of pre- Offer share capital of the Company, after the transfer of Sale Shares on a fully diluted basis(%) | Transfer price per Sale Share (₹) | Total consideration (in ₹ million) |
|--------|-----------------------|-----------------------------------|------------------------------------------------------------|-------------------|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|---------------------------------------------------------------|----------------------------------------------------------------------------------------------------------------------|-----------------------------------|------------------------------------|
| 1.     | Secondary Sale        | Avenue India Resurgence Pte. Ltd. | Whiteoak Capital India Opportunities Fund                  | September 7, 2026 | Not connected                                                                                                                                                                                                                                                    | 1,798,561                                                     | 0.55%                                                                                                                | 139.00                            | 249.99                             |
| 2.     | Secondary Sale        | Avenue India Resurgence Pte. Ltd. | Dymon Asia Multi-Strategy Investment (Singapore) Pte. Ltd. | September 7, 2026 | Not connected                                                                                                                                                                                                                                                    | 2,158,273                                                     | 0.66%                                                                                                                | 139.00                            | 299.99                             |
| Total  |                       |                                   |                                                            |                   |                                                                                                                                                                                                                                                                  | 3,956,834                                                     | 1.21%                                                                                                                | -                                 | 549.98                             |

\* For the purpose of this confirmation, (i) 'connected with' is deemed to mean that there are no common directorships, common key managerial personnel and/or there is not more than 1% equity investment interest.

% As on the date of this Addendum, our Company does not have any Group Companies.



BASIS FOR OFFER PRICE

(The "Basis for Offer Price" section on page 105 of the RHP has been updated with the above price band. Please refer to the websites of the BRLMs: www.iiflcapital.com, www.idbicapital.com and www.jmfl.com, respectively, for the "Basis for Offer Price" updated with the above price band), (you may scan the QR code for accessing the website of IIFL Capital Services Limited (formerly known as IIFL Securities Limited) )

An indicative timetable in respect of the Offer is set out below:

Submission of Bids (other than Bids from Anchor Investors):

| Bid/Offer Period (except the Bid/Offer Closing Date)                                                                                                                                                  |                                                                                                         |
|-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|---------------------------------------------------------------------------------------------------------|
| Submission and revision in Bids                                                                                                                                                                       | Only between 10.00 a.m. and 5.00 p.m. ("IST")                                                           |
| Bid/Offer Closing Date*                                                                                                                                                                               |                                                                                                         |
| Submission of electronic applications (Online ASBA through 3-in-1 accounts) – For RIBs                                                                                                                | Only between 10.00 a.m. and up to 5.00 p.m. IST                                                         |
| Submission of electronic applications (Bank ASBA through online channels like internet banking, mobile banking and syndicate UPI ASBA applications where Bid Amount is up to ₹ 0.50 million) For NIBs | Only between 10.00 a.m. and up to 4.00 p.m. IST                                                         |
| Submission of electronic applications (syndicate non-retail, non-individual applications of QIBs and NIBs)                                                                                            | Only between 10.00 a.m. and up to 3.00 p.m. IST                                                         |
| Submission of Physical Applications (Bank ASBA)                                                                                                                                                       | Only between 10.00 a.m. and up to 1.00 p.m. IST                                                         |
| Submission of Physical Applications (Syndicate Non-Retail, Non- Individual Applications of QIBs and NIBs where Bid Amount is more than ₹ 0.50 million                                                 | Only between 10.00 a.m. and up to 12.00 p.m. IST                                                        |
| Modification/ Revision/cancellation of Bids                                                                                                                                                           |                                                                                                         |
| Upward revision of Bids by QIBs and NIBs categories                                                                                                                                                   | Only between 10.00 a.m. on the Bid/Offer Opening Date and up to 4.00 p.m. IST on Bid/Offer Closing Date |
| Upward or downward Revision of Bids or cancellation of Bids by RIBs                                                                                                                                   | Only between 10.00 a.m. on the Bid/Offer Opening Date and up to 5.00 p.m. IST on Bid/Offer Closing Date |

\* UPI mandate end time and date shall be at 5.00pm on Bid/Offer Closing Date.

# QIBs and NIBs can neither revise their Bids downwards nor cancel/withdraw their Bids.

**ASBA**<sup>#</sup>

Simple, Safe, Smart way of Application!!!

# Applications supported by blocked amount (ASBA) is a better way of applying to issues by simply blocking the fund in the bank account. For further details, check section on ASBA.

Mandatory in public issues. No cheque will be accepted.



UPI-Now available in ASBA for Retail Individual Investors and Non - Institutional Investor applying for amount upto ₹ 5,00,000/-, applying through Registered Brokers, DPs and RTAs. UPI Bidder also have the option to submit the application directly to the ASBA Bank (SCSBs) or to use the facility of linked online trading, demat and bank account. Investors are required to ensure that the bank account used for bidding is linked to their PAN. Bidders must ensure that their PAN is linked with Aadhaar and are in compliance with CBDT notification dated February 13, 2020, issued by the Central Board of Direct Taxes and the subsequent press releases, including press releases dated June 25, 2021 and September 17, 2021 and CBDT circular no.7 of 2022, dated March 30, 2022 read with press release dated March 28, 2023 and any subsequent press releases in this regard.

ASBA has to be availed by all the investors except Anchor Investors. UPI may be availed by (i) Retail Individual Investors in the Retail Portion; (ii) Non-Institutional Investors with an application size of up to ₹ 0.50 million in the Non-Institutional Portion. For details on the ASBA and UPI process, please refer to the details given in ASBA form and abridged prospectus and also please refer to the section "Offer Procedure" on page 477 of the RHP. The process is also available on the website of Association of Investment Bankers of India ("AIBI") and Stock Exchanges and in the General Information Document. ASBA bid-cum-application forms can be downloaded from the websites of the Stock Exchanges and can be obtained from the list of banks that is displayed on the website of SEBI at [www.sebi.gov.in/sebiweb/other/OtherAction.do?doRecognisedFpi=yes&intmid=35](http://www.sebi.gov.in/sebiweb/other/OtherAction.do?doRecognisedFpi=yes&intmid=35) and <https://www.sebi.gov.in/sebiweb/other/OtherAction.do?doRecognisedFpi=yes&intmid=43>, respectively as updated from time to time. For the list of UPI apps and banks live on IPO, please refer to the link: [www.sebi.gov.in](http://www.sebi.gov.in). UPI Bidders Bidding using the UPI mechanism may apply through the SCSBs and mobile applications whose names appear on the website of SEBI, as updated from time to time. HDFC Bank Limited and Kotak Mahindra Bank Limited have been appointed as Sponsor Banks for the Offer, in accordance with the requirements of the SEBI Circular dated November 1, 2018 as amended. For Offer related queries, please contact the BRLM on its email IDs as mentioned below. For UPI related queries, investors can contact NPCI at the toll free number: 18001201740 and mail id: [ipo.upi@gpcc.org.in](mailto:ipo.upi@gpcc.org.in).

THE EQUITY SHARES OF OUR COMPANY WILL GET LISTED ON MAIN BOARD PLATFORM OF THE STOCK EXCHANGES

In case of any revision in the Price Band, the Bid/ Offer Period shall be extended for at least three additional Working Days after such revision of the Price Band, subject to the total Bid/Offer Period not exceeding 10 Working Days. In cases of force majeure, banking strike or similar unforeseen circumstances, our Company, in consultation with the BRLMs, for reasons to be recorded in writing, may extend the Bid / Offer Period for a minimum of one Working Day, subject to the Bid/ Offer Period not exceeding 10 Working Days. Any revision in the Price Band, and the revised Bid/ Offer Period, if applicable, shall be widely disseminated by notification to the Stock Exchanges by issuing a public notice and also by indicating the change on the respective websites of the BRLMs and at the terminals of the members of the Syndicate and by intimation to the Self-Certified Syndicate Banks ("SCSBs") and by intimation to Designated Intermediaries and Sponsor Bank(s), as applicable.

The Offer is being made in terms of Rule 19(2)(b) of the Securities Contracts (Regulation) Rules, 1957, as amended (the "SCRR"), read with Regulation 31 of the SEBI ICDR Regulations. The Offer is being made in accordance with Regulation 6(1) of the SEBI ICDR Regulations, through the Book Building Process wherein not more than 50% of the Offer shall be available for allocation on a proportionate basis to Qualified Institutional Buyers ("QIBs") (such portion referred to as "QIB Portion"), provided that our Company in consultation with the BRLMs, may allocate up to 60% of the QIB Portion to Anchor Investors on a discretionary basis in accordance with the SEBI ICDR Regulations (the "Anchor Investor Portion"), of which up to 40% of the Anchor Investor Portion shall be reserved in the following manner: (i) 33.33% shall be reserved for allocation to domestic Mutual Funds, and (ii) up to 6.67% shall be reserved for life insurance companies and pension funds, subject to valid Bids being received from domestic Mutual Funds, life insurance companies and pension funds respectively at or above the price at which allocation is made to Anchor Investors ("Anchor Investor Allocation Price"), in accordance with the SEBI ICDR Regulations. In the event of under-subscription in (ii) above, the allocation may be made to domestic Mutual Funds. In the event of under-subscription or non-allocation in the Anchor Investor Portion, the balance Equity Shares shall be added to the QIB Portion (excluding the Anchor Investor Portion) (the "Net QIB Portion"). Further, 5% of the Net QIB Portion shall be available for allocation on a proportionate basis to Mutual Funds only, and the remainder of the Net QIB Portion shall be available for allocation on a proportionate basis to all QIB Bidders (other than Anchor Investors), including Mutual Funds, subject to valid Bids being received at or above the Offer Price. However, if the aggregate demand from Mutual Funds is less than 5% of the Net QIB Portion, the balance Equity Shares available for allocation in the Mutual Fund Portion will be added to the remaining Net QIB Portion for proportionate allocation to all QIBs. Further, not less than 15% of the Offer shall be available for allocation on a proportionate basis to Non-Institutional Investors out of which (a) one-third of such portion shall be reserved for applicants with application size of more than ₹20.00 million and up to ₹1.00 million; and (b) two third of such portion shall be reserved for applicants with application size of more than ₹1.00 million, provided that the unsubscribed portion in either of such sub-categories may be allocated to applicants in the other sub-category of Non-Institutional Investors and not less than 35% of the Offer shall be available for allocation to Retail Individual Investors in accordance with the SEBI ICDR Regulations, subject to valid Bids being received at or above the Offer Price. All potential Bidders (except Anchor Investors) are required to mandatorily use the Application Supported by Blocked Amount ("ASBA") process providing details of their respective ASBA accounts, and UPI ID in case of UPI Bidders, if applicable, in which the corresponding Bid Amounts will be blocked by the SCSBs or by the Sponsor Bank(s) under the UPI Mechanism, as applicable, to the extent of the respective Bid Amounts. Anchor Investors are not permitted to participate in the Offer through the ASBA process. For further details, see "Offer Procedure" on page 477 of the RHP.

Bidders/Applicants should ensure that DP ID, PAN, Client ID and UPI ID (for UPI Bidders bidding through the UPI Mechanism) are correctly filled in the Bid cum Application Form. The DP ID, PAN and Client ID provided in the Bid cum Application Form should match with the DP ID, PAN, Client ID available in the Depository database, otherwise, the Bid cum Application Form is liable to be rejected. Bidders/Applicants should ensure that the beneficiary account provided in the Bid cum Application Form is active. Bidders/Applicants should note that on the basis of the PAN, DP ID, Client ID and UPI ID (for UPI Bidders bidding through the UPI Mechanism) as provided in the Bid cum Application Form, the Bidder/Applicant may be deemed to have authorised the Depositories to provide to the Registrar to the Offer, any requested Demographic Details of the Bidder/Applicant as available on the records of the depositories. These Demographic Details may be used, among other things, for giving Allotment Advice or unblocking of ASBA Account or for other correspondence(s) related to the Offer. Bidders/Applicants are advised to update any changes to their Demographic Details as available in the records of

the Depository Participant to ensure accuracy of records. Any delay resulting from failure to update the Demographic Details would be at the Bidders/Applicants' sole risk. Investors must ensure that their PAN is linked with Aadhaar and are in compliance with CBDT notification dated February 13, 2020 and press release dated June 25, 2021, read with press release dated September 17, 2021 and CBDT circular no.7 of 2022, dated March 30, 2022 read with press release dated March 28, 2023 and any subsequent press releases in this regard.

Contents of the Memorandum of Association of our Company as regards its objects: For information on the main objects of our Company, please see the section "History and Certain Corporate Matters - Main Objects of our Company" on page 210 of the RHP. The Memorandum of Association of our Company is a material document for inspection in relation to the Offer. For further details, please see the section titled "Material Contracts and Documents for Inspection" on page 555 of the RHP.

Liability of the members of our Company: Limited by shares

Amount of share capital of our Company and Capital structure: As on the date of the RHP, the authorised share capital of the Company is ₹5,000,000,000 divided into 500,000,000 Equity Shares of face value of ₹10 each. The issued, subscribed and paid-up share capital of the Company is ₹3,248,971,400 divided into 324,897,140 Equity Shares of face value of ₹10 each. For details, please see the section titled "Capital Structure" beginning on page 87 of the RHP.

Names of signatories to the Memorandum of Association of our Company and the number of Equity Shares subscribed by them: The names of the initial signatories of the Memorandum of Association of our Company are: Jyoti Mehta, R. Vedaasagar, Krishnan Ranganathan, Vijaya Rao, Nilesh Trivedi, Pramod Rao and Rajesh S. Chawathe. For details of the share capital history of our Company, please see the section titled "Capital Structure" beginning on page 87 of the RHP.

Listing: The Equity Shares offered through the Red Herring Prospectus are proposed to be listed on the Stock Exchanges. Our Company has received in-principle approvals from BSE and NSE for listing of the Equity Shares pursuant to their letters each dated September 19, 2025. For the purposes of the Offer, NSE shall be the Designated Stock Exchange. A signed copy of the Red Herring Prospectus and the Prospectus shall be filed with the RoC in accordance with Section 26(4) and 32 of the Companies Act, 2013. For details of the material contracts and documents available for inspection from the date of the Red Herring Prospectus up to the Bid/Offer Closing Date, see "Material Contracts and Documents for Inspection" on page 555 of the RHP.

Disclaimer Clause of the Securities and Exchange Board of India ("SEBI"): SEBI only gives its observations on the Offer documents and this does not constitute approval of either the Offer or the specified securities stated in the Offer Documents. The investors are advised to refer to page 455 of the RHP for the full text of the disclaimer clause of SEBI.

Disclaimer Clause of NSE (Designated Stock Exchange) : It is to be distinctly understood that the permission given by NSE should not in any way be deemed or construed that the Offer Document has been cleared or approved by NSE nor does it certify the correctness or completeness of any of the contents of the RHP and read with Addendum. The investors are advised to refer to page 457 of the RHP for the full text of the disclaimer clause of NSE.

Disclaimer Clause of BSE : It is to be distinctly understood that the permission given by BSE should not in any way be deemed or construed that the RHP and read with Addendum has been cleared or approved by BSE nor does it certify the correctness or completeness of any of the contents of the RHP. The investors are advised to refer to page 457 of the RHP for the full text of the disclaimer clause of BSE.

General Risk: Investments in equity and equity-related securities involve a degree of risk and investors should not invest any funds in this Offer unless they can afford to take the risk of losing their entire investment. Investors are advised to read the risk factors carefully before taking an investment decision in this Offer. For taking an investment decision, investors must rely on their own examination of our Company and the Offer, including the risks involved. The Equity Shares of face value of ₹10 each in the Offer have not been recommended or approved by the SEBI, nor does SEBI guarantee the accuracy or adequacy of the contents of the Red Herring Prospectus and read with Addendum. Specific attention of the investors is invited to "Risk Factors" on page 24 of the RHP.

| BOOK RUNNING LEAD MANAGERS                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                           |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 | REGISTRAR TO THE OFFER                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   | COMPANY SECRETARY AND COMPLIANCE OFFICER, HEAD CSR                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        |
|--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
|                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                    |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                           |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                          | Ameeth Ashok Kela<br>The Ruby, 10 <sup>th</sup> Floor, 29 Senapati Bapat Marg, Dadar (West), Mumbai – 400 028<br>Maharashtra, India<br>Tel: +91 22-66581300<br>E-mail: <a href="mailto:cs@arcl.co.in">cs@arcl.co.in</a>                                                                                                                                                                                                                                                   |
| IIFL Capital Services Limited<br>(formerly known as IIFL Securities Limited)<br>24 <sup>th</sup> Floor, One Lodha Place, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai - 400 013, Maharashtra, India<br>Tel: +91 22 4646 4728<br>E-mail: <a href="mailto:arcl ipo@iiflcap.com">arcl ipo@iiflcap.com</a><br>Website: <a href="http://www.iiflcapital.com">www.iiflcapital.com</a><br>Investor Grievance E-mail: <a href="mailto:ig_ib@iiflcap.com">ig_ib@iiflcap.com</a><br>Contact Person: Nishita Mody/ Pawan Kumar Jain<br>SEBI Registration No.: INM000010940 | IDBI Capital Markets & Securities Limited<br>6 <sup>th</sup> Floor, IDBI Tower, WTC Complex, Cuffe Parade Mumbai - 400 005, Maharashtra, India<br>Tel: +91 22 4069 1953<br>E-mail: <a href="mailto:arcl.ipo@idbicapital.com">arcl.ipo@idbicapital.com</a><br>Website: <a href="http://www.idbicapital.com">www.idbicapital.com</a><br>Investor Grievance E-mail: <a href="mailto:redressal@idbicapital.com">redressal@idbicapital.com</a><br>Contact Person: Indrajit Bhagat/ Sri Krishna Tapariya<br>SEBI Registration No.: INM000010866 | JM Financial Limited<br>7 <sup>th</sup> Floor, Cnergy, Appasaheb Marathe Marg, Prabhadevi Mumbai - 400 025, Maharashtra, India<br>Tel: +91 22 6630 3030<br>E-mail: <a href="mailto:arcl.ipo@jmfl.com">arcl.ipo@jmfl.com</a><br>Website: <a href="http://www.jmfl.com">www.jmfl.com</a><br>Investor Grievance E-mail: <a href="mailto:grievance.ibd@jmfl.com">grievance.ibd@jmfl.com</a><br>Contact Person: Prachee Dhuri<br>SEBI Registration No.: INM000010361 | MUFG Intime India Private Limited<br>(Formerly Link Intime India Private Limited)<br>C-101, 1 <sup>st</sup> Floor, 247 Park, Lal Bhadur Shastri Marg, Vikhroli (West) Mumbai - 400 083, Maharashtra, India<br>Tel: +91 810 811 4949<br>E-mail: <a href="mailto:arcl@in.mpmfsmufg.com">arcl@in.mpmfsmufg.com</a><br>Website: <a href="http://www.in.mpmfsmufg.com">www.in.mpmfsmufg.com</a><br>Investor grievance e-mail: <a href="mailto:arcl@in.mpmfsmufg.com">arcl@in.mpmfsmufg.com</a><br>Contact Person: Shanti Gopalkrishnan<br>SEBI Registration No.: INR000004058 | Investors may contact the Company Secretary and Compliance Officer or the Registrar to the Offer in case of any pre-Offer or post-Offer related grievances including non-receipt of letters of Allotment, non-credit of Allotted Equity Shares in the respective beneficiary account, non-receipt of refund orders or non-receipt of funds by electronic mode, etc. For all Offer related queries and for redressal of complaints, Investors may also write to the BRLMs. |

AVAILABILITY OF THE RHP: Investors are advised to refer to the RHP, read with Addendum and the section titled "Risk Factors" on page 24 of the RHP, before applying in the Offer. A copy of the RHP is available on website of SEBI at [www.sebi.gov.in](http://www.sebi.gov.in), websites of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com), respectively, and on the website of the website of the Company at [www.arcl.co.in](http://www.arcl.co.in); and on the websites of the BRLMs, i.e. IIFL Capital Services Limited (formerly known as IIFL Securities Limited), IDBI Capital Markets & Securities Limited and JM Financial Limited at [www.iiflcapital.com](http://www.iiflcapital.com), [www.idbicapital.com](http://www.idbicapital.com) and [www.jmfl.com](http://www.jmfl.com), respectively.

AVAILABILITY OF THE ABRIDGED PROSPECTUS: A copy of the abridged prospectus shall be available on the website of the Company, the BRLMs and the Registrar to the Offer at [www.arcl.co.in](http://www.arcl.co.in), [www.iiflcapital.com](http://www.iiflcapital.com), [www.idbicapital.com](http://www.idbicapital.com), [www.jmfl.com](http://www.jmfl.com) and [www.in.mpmfsmufg.com](http://www.in.mpmfsmufg.com), respectively.

AVAILABILITY OF BID CUM APPLICATION FORMS: Bid cum Application Forms can be obtained from the Registered and Corporate Office of ASSET RECONSTRUCTION COMPANY (INDIA) LIMITED, Tel: +91 22-66581300; BRLMs : IIFL Capital Services Limited (formerly known as IIFL Securities Limited), Tel: +91 22 4646 4728, IDBI Capital Markets & Securities Limited, Tel: +91 22 4069 1953 and JM Financial Limited, Tel: +91 22 6630 3030 at the select locations of the Sub-syndicate Members (as given below), SCSBs, Registered Brokers, RTAs and CDPs participating in the Offer. Bid cum Application Forms will also be available on the websites of BSE and NSE and the Designated Branches of SCSBs, the list of which is available at websites of the Stock Exchanges and SEBI.

Syndicate Members: JM Financial Services Limited,

Sub-Syndicate Members: Almondz Global Securities Limited, Ambit Capital Limited, Anand Rathi Share & Stock Brokers Limited, Asit C Mehta Financial Services Limited, Axis Capital Limited, Bajaj Financial Securities Limited, Centrum Capital Advisors Limited, Centrum Finverse Ltd, Eurekha Stock & Share Broking Services Limited, Globe Capital Market Limited, HDFC Securities Limited, ICICI Securities Limited, Jobanputra Fiscal Services Pvt. Ltd., Keynote Capital Limited, KJMC Capital Market Services Limited, Kotak Securities Limited, LKP Securities Limited, Motilal Oswal Financial Services Limited, Nuvama Wealth and Investment Limited, Nuvama Wealth Management Limited, Pantomath Financial Services Limited, Prabhudas Lilladher Private Limited, Pravin Ratilal Share and Stock Brokers Limited, Religare Securities Limited, RR Equity Brokers Private Limited, SBICAP Securities Limited, Sharekhan Limited, SMC Global Securities Limited, Standard Chartered Securities, Tradebulls Securities Private Limited, Trust Securities Limited and YES Securities (India) Limited

•Escrow Collection Bank : HDFC Bank Limited •Public Offer Account Bank and Refund Bank : Kotak Mahindra Bank Limited •Sponsor Banks : HDFC Bank Limited and Kotak Mahindra Bank Limited

UPI: UPI Bidders can also bid through UPI mechanism

All capitalized terms used herein and not specifically defined shall have the same meaning as ascribed to them in the RHP and read with Addendum.

For ASSET RECONSTRUCTION COMPANY (INDIA) LIMITED  
On behalf of the Board of Directors  
Sd/-  
Ameeth Ashok Kela  
Company Secretary and Compliance Officer, Head CSR

Place: Mumbai  
Date: September 8, 2026

ASSET RECONSTRUCTION COMPANY (INDIA) LIMITED is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public offering of its Equity Shares and filed the RHP with RoC and the Stock Exchanges on September 1, 2026 and read with Addendum dated September 7, 2026. The RHP is available on the website of SEBI at [www.sebi.gov.in](http://www.sebi.gov.in), as well as on the websites of the Stock Exchanges i.e. BSE and NSE at [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com), respectively, on the website of our Company at [www.arcl.co.in](http://www.arcl.co.in); and on the websites of the BRLMs, i.e. IIFL Capital Services Limited (formerly known as IIFL Securities Limited), IDBI Capital Markets & Securities Limited and JM Financial Limited at [www.iiflcapital.com](http://www.iiflcapital.com), [www.idbicapital.com](http://www.idbicapital.com) and [www.jmfl.com](http://www.jmfl.com), respectively. Any potential investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, see "Risk Factors" beginning on page 24 of the RHP. Potential investors should not rely on the DRHP filed with SEBI and the Stock Exchanges, and should instead rely on the RHP, read with Addendum, for making any investment decision.

The Equity Shares offered in the Offer have not been and will not be registered under the U.S. Securities Act or any state securities laws in the United States, and unless so registered, may not be offered or sold within the United States, except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the U.S. Securities Act and applicable state securities laws. Accordingly, the Equity Shares are being offered and sold outside the United States in "offshore transactions" as defined in and in reliance on Regulation S under the U.S. Securities Act and the applicable laws of the jurisdictions where such offers and sales are made.

## નયારા એનર્જી દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા પાથમેકર્સ પહેલનો પ્રારંભ

જામનગર જિલ્લાની ઉચ્ચ માધ્યમિક શાળાઓના ૫૦૦ શિક્ષકો તાલીમમાં જોડાયા : પ્રશિક્ષિત શિક્ષકો વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અને જવાબદારી અંગેના પાઠ ભણાવશે



જામનગર, આંતરરાષ્ટ્રીય સંકલિત ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની, નયારા એનર્જીએ માર્ગ સલામતી જાગૃતિ અને જવાબદાર માર્ગ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે "પાથ મેકર્સ" પહેલ શરૂ કરી છે.

આ કાર્યક્રમના ભાગ રૂપે, ઉચ્ચ માધ્યમિક શાળાના ૫૦૦ શિક્ષકોએ માર્ગ સલામતી પ્રથાઓ, ટ્રાફિક નિયમો અને સલામત માર્ગ વર્તન પર કેન્દ્રિત ચાર કલાકના વ્યાપક તાલીમ સત્રમાં ભાગ લીધો હતો. આ શિક્ષકો તેમની સંબંધિત

શાળાઓમાં માર્ગ સલામતી રાજદૂત તરીકે સેવા આપશે, વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતીની સંસ્કૃતિ સ્થાપિત કરવામાં મદદ કરશે અને જવાબદાર પ્રથાઓને પ્રોત્સાહિત કરશે જે સુરક્ષિત સમુદાયોમાં ફાળો આપી શકે છે. જામનગર જિલ્લા કલેક્ટરશ્રી પી. બી. પંડ્યાએ આ શિક્ષક તાલીમ કાર્યક્રમની શરૂઆત રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓની હાજરીમાં માર્ગ સલામતી ટીઆરએએકસ સોસાયટીના સહયોગથી જામનગરની નવાનગર સરકારી હાઈસ્કૂલ, શ્રી

દિગ્વિજયસિંહજી સરકારી હાઈસ્કૂલ, કાલાવડની મ્યુનિસિપલ હાઈસ્કૂલ, લાલપુરની વીર સાવરકર હાઈસ્કૂલ, પ્રોલની હરપ્રોલ સરકારી હાઈસ્કૂલ અને જામજોધપુરની એસવીપી હાઈસ્કૂલમાં જિલ્લાના આશરે ૫૦૦થી વધુ શિક્ષકોને માર્ગ સલામતી અંગે ઊંડાણપૂર્વકની તાલીમ આપવામાં આવી હતી. નયારા એનર્જીની આ પહેલનો હેતુ શિક્ષકોની ક્ષમતા વધારીને શાળાઓમાં માર્ગ સલામતી જાગૃતિને મજબૂત કરવાનો છે, જે વિદ્યાર્થીઓ અને વ્યાપક સમુદાયમાં શિક્ષણનો વધુ પ્રસાર કરશે.

## રાજકોટમાં સ્વયંભુ શ્રીરામનાથ મહાદેવની વાજતે ગાજતે વર્ષાગી નીકળી



રાજકોટ, રાજકોટ આજનદી કાંઠે બિરાજતા પ્રાચીન સ્વયંભુ શ્રીરામનાથ મહાદેવની ૧૦૩મી વર્ષાગીનું વાજતે ગાજતે આયોજન થયું હતું. લોકોની સુખાકારી માટે જે તે સમયે પ્રજાવત્સલ રાજવી શ્રી લાખાજીરાજ બાપુએ સૌ પ્રથમ વર્ષાગી આયોજીત આ પરંપરાની શરૂઆત કરાવી હતી. આ વર્ષે પણ ૧૦૩મી વર્ષાગી યોજવામાં આવતા હરહર મહાદેવના નાદ સાથે રામનાથ મંદિરેથી પ્રારંભ કરાયો હતો. સુશોભિત પાલખીમાં દાદાને બિરાજમાન કરી શરૂ થયેલ આ પાલખીયાગ્રાની જ રામનાથપરા મંદિરેથી પ્રારંભ થઈ કોઠારીયા નાકા, પેલેસરોડ, જયરાજ પ્લોટ, હાથીખાના થઈ રામનાથ મંદિરે પરત ફરી હતી. માર્ગો પર ઠેરઠેર ભક્તો દ્વારા સ્વાગત કરાયું હતું. બહોળી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું

## રાજકોટના રણછોડદાસજી બાપુ આશ્રમમાં શ્રાવણ માસની અમાસના દિને હોમાત્મક યજ્ઞ સાથે પૂર્ણાહુતિ

રાજકોટ, રાજકોટના પ.પૂ. શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ (શ્રી સદગુરુ સદન ટ્રસ્ટ)ના પ્રાંગણમાં ભારત દેશના ઉત્થાન તથા સર્વ લોકોની સુખાકારી માટે તથા સમગ્ર ધર્મપ્રેમી ભાઈ-બહેનોને બાર જયોતિર્લીંગ તથા ત્રંબકેશ્વર મહાદેવ ૧૧,૨૫,૦૦૦ બીલીપત્ર અનુષ્ઠાન તથા પવિત્ર શ્રાવણ માસમાં લોકોની આપિ, વ્યાપિ, ઉપાધિમાં મુક્ત થાય અને જીવનમાં શાંતિ અને સુખાકારી વધે એ માટે આખો સુંદરકાંડનું સંગીતમયી આયોજન કરવામાં આવેલ હતું. આ ધાર્મિક ત્રંબકેશ્વર મહાદેવ ૧૧,૨૫,૦૦૦ બીલીપત્ર અનુષ્ઠાન, દ્વાદશ જયોતિર્લીંગ દર્શન, ગંગાવાયા દર્શન તથા સુંદરકાંડ પાઠનું શ્રાવણ વદ-૩૦ (અમાસ), તા. ૧૧ શુક્રવારે



સવારે ૬ વાગ્યે હોમાત્મક યજ્ઞ કરવામાં આવશે અને આ હોમાત્મક યજ્ઞ દ્વારા પૂર્ણાહુતિ કરવામાં આવશે. જે ગુરુદેવ ભગવાનને અર્પણ કરવામાં આવશે. પવિત્ર શ્રાવણ માસમાં પુર્ણ થવાનો હોય અને આશ્રમમાં આ ત્રિવેણી સંગમ સમા ધાર્મિક અનુષ્ઠાન, જયોતિર્લીંગ દર્શન અને સુંદરકાંડનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

## રાજકોટ સરગમ કલબદ્વારા દિવ્યાંગો માટે ત્રિ-દિવસીય જયપુર ફૂટ કેમ્પ યોજાયો

રાજકોટ, રાજકોટ સરગમ કલબ શહેરમાં જયપુર ફૂટ કેમ્પના રૂપમાં વધુ એક સેવા કેન્દ્ર ચલાવી રહેલ છે. સરગમ કલબ અને માતળશ્રી કલાવંતીબેન ભૂપતલાલ માઉના સમૂહક ઉપક્રમે ત્રિદિવસીય જયપુર જયપુર કેમ્પ યોજાયેલ. આ કેમ્પમાં કુલ ૫૬ દર્દીઓ એ લાભ લીધો હતો. જેમાં કેલીપર્સ નાં દર્દી ૨૧- (લેગ) પગ નાં દર્દી ૧૮ અને રીપેરિંગ ૧૬ દર્દીએ વિનામૂલ્યે લાભ લીધો.

સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને માતુશ્રી કલાવંતીબેન ભૂપતલાલ માઉ જણાવ્યા અનુસાર આ કેમ્પમાં જરૂરતમંદોને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે. આ કેમ્પની સફળતા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ માતુશ્રી કલાવંતીબેન ભૂપતલાલ માઉના અને કમાણી ફાઉન્ડેશનનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કેમ્પને સફળ બનાવવા દીપકભાઈ કમાણી, રશ્મિભાઈ કમાણી,



કિશોરભાઈ પરમાર, જે. કે. સરાહે તથા સરગમ કલબના કમિટી મેમ્બર અનવરભાઈ ઢેબા, કનૈયાલાલ ગજેરા તેમજ કેલાશબા વાળા, અલકાબેન કામદાર, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન વ્યાસ, દિવ્યબેન ઉમરાણીયા, મિતલબેન ચુગ, મધુરીકાબેન જાડેજા, સુધાબેન દોશી, હર્ષબેન કશ્યપ, નિશાબેન વડગામા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

આ કેમ્પમાં રાજસ્થાનનાં ડોક્ટરો જગનલાલ ચૌધરી, હેમંત શર્મા, તુફાનસિંહ તોમર વગેરેએ સેવા આપેલે આવનારા તમામ દર્દીઓને વિના મૂલ્યેન ચા પાણી આપવામાં આવેલ. આગામી કેમ્પ તા. ૧/૧૦/૨૦૨૬ નાં રોજ ૩ દિવસ માટે યોજાશે.

## રાજકોટમાં દુરબીન વડે જટિલ સર્જરી

વૃદ્ધાની અન્નળીમાંથી ૧.૫ સેમીની ગોળી તોડ્યા વિના એક જ ટુકડામાં બહાર કાઢી નવજીવન આપ્યું

રાજકોટ, રાજકોટમાં એક ચૌકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ૭૦ વર્ષીય વૃદ્ધા સાંધાના દુખાવાની ૧.૫ સેમીની આયુર્વેદિક ગોળી ગળવા જતાં તે અન્નળીના ઉપરના ભાગમાં સાંકડાપણા (સ્ટ્રિક્ચર)ના કારણે ફસાઈ ગઈ હતી. દર્દી આખો દિવસ પાણી પછા ગળી શકતા નહોતા અને અસહ્ય દુખાવાથી પીડાતા હતા. ENT નિષ્ણાતે જનરલ એનેસ્થેશિયા હેઠળ વિશેષ એન્ડોસ્કોપિક ટેકનિકથી આ અત્યંત કઠણ ગોળીને તોડ્યા વગર એક ટુકડામાં સફળતાપૂર્વક બહાર કાઢી હતી. અન્નળીમાંથી ગોળી બહાર કાઢતાં જ દર્દીને તાત્કાલિક રાહત મળી હતી અને ૨ કલાકના ઓબ્ઝર્વેશન બાદ રજા આપવામાં આવી હતી. આ ઓપરેશનનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે.

પ્રાથમ વિગત મુજબ રાજકોટના જાણીતા ENT સર્જન ડૉ. હિમાંશુ ઠક્કરે રાજકોટના ૭૦ વર્ષીય દેવિકાબેન વ્યાસની અન્નળીમાં ફસાયેલી આશરે ૧.૫ સેમીની અત્યંત કઠણ આયુર્વેદિક ગોળી સફળતાપૂર્વક દૂર કરી દર્દીને યાતના મુક્ત કર્યા છે. દર્દી ઘૂંટણ અને સાંધાના દુખાવા માટે આયુર્વેદિક ગોળી લેતા હતા. ગોળી ગળતી વખતે તે અચાનક અન્નળીના ઉપરના ભાગમાં ફસાઈ ગઈ હતી. ગોળી ફસાઈ જવાના કારણે દર્દી આખો દિવસ પાણી પછા ગળી શક્યા નહોતા અને ગળામાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેમને સારવાર અર્થે ઠક્કર ઈન્ડ એન્ડ નેટલ સર્જીકલ હોસ્પિટલ, રાજકોટ ખાતે લાવવામાં આવ્યા હતા.



તપાસ દરમિયાન અન્નળીના ઉપરના ભાગમાં અવરોધ હોવાનું માલુમ પડતા દર્દીની તાત્કાલિક જનરલ એનેસ્થેશિયા હેઠળ એન્ડોસ્કોપિક પ્રક્રિયા કરવામાં આવી હતી. ઈસોફે ગેસોપે અને વિશેષ ફોર્સેપ્સની મદદથી આ અત્યંત કઠણ ગોળીને તોડ્યા વગર, એક જ ટુકડામાં કાળજીપૂર્વક બહાર કાઢવામાં આવી હતી. ગોળી બહાર નીકળતા જ દર્દીને તાત્કાલિક રાહત મળી હતી અને પાણી

તથા ખોરાક ગળવામાં થતી તકલીફ દૂર થઈ ગઈ હતી. દર્દીને આશરે ૨ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ રજા આપવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે દર્દીની અન્નળીના ઉપરના ભાગમાં સાંકડાપણું (સ્ટ્રિક્ચર) હતું. ડૉ. હિમાંશુ ઠક્કરે જણાવ્યું કે, આવા સાંકડાપણાને કારણે સામાન્ય કદની ગોળી, વટાણા જેવી વસ્તુ કે ખોરાકનો મોટો ટુકડો પણ અન્નળીમાં ફસાઈ શકે છે. વૃદ્ધોમાં દાંત ઓછા હોવા કે ચાવવામાં તકલીફના કારણે આવી ઘટનાઓનું જોખમ રહે છે. ક્યારેક અન્નળીના સાંકડાપણા પાછળ Plummer-Vinson syndrome પણ જવાબદાર હોઈ શકે છે, જે આયર્નની ઉપશી થતા એનિમિયા સાથે સંકળાયેલ છે. તેથી આવા કિસ્સામાં યોગ્ય રક્ત તપાસ અને ગળાની તપાસ કરાવવી જરૂરી છે.



વધુમાં તેમણે ઉમેર્યું કે ગળેલી વસ્તુ અન્નળીના બદલે થાસનળીમાં જાય તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી વૃદ્ધોએ કઠણ ગોળી કે ખોરાક ગળતી વખતે વિશેષ સાવચેતી રાખવી અને વારંવાર ગળવામાં તકલીફ થાય તો તાત્કાલિક ઈન્ડ નિષ્ણાતની સલાહ લેવી. જો ખોરાક કે ગોળી ગળામાં ફસાય તો ઘરગથ્થુ ઉપચારમાં સમય બગાડ્યા વગર તબીબી સારવાર લેવી હિતાવલ છે. આ પ્રકારની કોઈપણ તકલીફ થાય તો તાત્કાલિક નજીકના ડોક્ટરનો સંપર્ક કરવા તેમણે જણાવ્યું હતું.

## શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત, પુષ્પવર્ષા સાથે કોમી એકતાનો પ્રેરણાદાયી સંદેશ



રાજકોટ: જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરના રાજમાર્ગો પર યોજાયેલી ભવ્ય શ્રીકૃષ્ણ જન્મોત્સવ શોભાયાત્રા નું સદર બજાર વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારા ના તાલ સાથે શોભાયાત્રા પર પુષ્પવર્ષા કરી કોમી એકતા, ભાઈચારો અને સર્વધર્મ સમભાવનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો. રાજકોટ સદર બજાર મા નીકળતી શ્રીકૃષ્ણ જન્મોત્સવ

ભવ્ય શોભાયાત્રાનું સ્વાગત કરવાની પરંપરા સદર બજાર વિસ્તારના કોમી એકતાના હિમાયતી મરહુમ ગનીબાપુ કાળાભાઈ કટારિયા દ્વારા શરૂ કરવામાં આવી હતી. છેલ્લા અનેક વર્ષોથી આ પરંપરાને તેમના પરિવારજનો અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સતત નિભાવવામાં આવી રહી છે, જે શહેરમાં કોમી સૌહાર્દનું અનોખું ઉદાહરણ બની છે. આ પ્રસંગે રાજકોટ સદર તાજિયા કમિટીના પ્રમુખ હબીબભાઈ ગનીબાપુ કટારિયાના માર્ગદર્શન

હેઠળ નરેશભાઈ દેવીપૂજક, આસીફભાઈ ખોખર, સોયબભાઈ સોદાગર, હનીફભાઈ જુનાગઢી, આબિદભાઈ શેખ, હનીફભાઈ માંડરીયા, યુનુસ ભાઈ કટારિયા, યુસુફભાઈ ગનીબાપુ કટારિયા, હનીફભાઈ ગનીબાપુ કટારિયા, રફીકભાઈ ગનીબાપુ કટારિયા, શકીલભાઈ હબીબભાઈ કટારિયા તથા સુફીયાનભાઈ યુસુફભાઈ કટારિયા સહિતના આગેવાનોએ ઢોલ-નગારાના તાલ સાથે શોભાયાત્રાનું હાર્દિક સ્વાગત કરી પુષ્પવર્ષા કરી હતી. શોભાયાત્રામાં જોડાયેલા ભક્તોએ પણ મુસ્લિમ

સમાજના આ સ્નેહભર્યા સ્વાગતને વધાવી લીધું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય માન. શ્રી ગોવિંદભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નાગદાનભાઈ ચાવડા, કારડિયા રજપૂત સમાજના અરુણ ભાઈ પરમાર જે દર વર્ષે હનુમાન જી બને છે, રાધેશ્યામ ગૌશાળાના રાધેશ્યામ બાપુ, જયંતિભાઈ તરૈયા તેમજ સંત-મહતો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોને પુષ્પહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. હબીબભાઈ ગનીબાપુ કટારિયા એ જણાવ્યું હતું કે ધાર્મિક

તહેવારો સમાજને એકબીજા સાથે જોડવાનું કાર્ય કરે છે. રાજકોટની ગંગા-જમની તહેઝીબ, પરસ્પર પ્રેમ અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે આવા કાર્યક્રમો સમાજને નવી દિશા આપે છે. આવનારા સમયમાં પણ કોમી એકતા અને સામાજિક સૌહાર્દની આ સુંદર પરંપરા યથાવત રાખવામાં આવશે. હબીબભાઈ ગનીબાપુ કટારિયા, આસીફ ભાઈ ખોખર તથા સોયબભાઈ સોદાગર ઉપસ્થિત મહાનુભાવો તેમજ તમામ સમાજના આગેવાનો ની યાદિ માં જણાવ્યું છે

## રાજકોટ સરકારી ઈજનેરી કોલેજ અધ્યાપક મંડળે દિવંગતના પરિવારને સહાય આપી



રાજકોટ, ૫ સપ્ટેમ્બર શિક્ષક દિર્ન નિમિત્તે શિક્ષક અને અધ્યાપક સમુદાયની એકતા, સંવેદના અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂપાડતી ઘટના સામે આવી છે. સરકારી ઈજનેરી કોલેજ, પાલનપુર ખાતે ફરજ બજાવતા સ્વ. અલ્પેશકુમાર બાબુભાઈ પટેલ, સહાયક પ્રાધ્યાપક (મિકેનિકલ વિભાગ), નું તા. ૧૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ અકાળે અવસાન થયું હતું. તેઓ તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૧૩થી સરકારી ઈજનેરી કોલેજ, પાલનપુર ખાતે તથા એપ્રિલ ૨૦૧૦થી ડિસેમ્બર

૨૦૧૩ દરમિયાન એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ, અમદાવાદ ખાતે સેવા આપી ચૂક્યા હતા. સ્વ. અલ્પેશકુમાર પટેલના અકાળે અવસાનથી તેમના પરિવાર પર આવેલી મુશ્કેલ પરિસ્થિતિમાં સહકાર આપવા માટે ઈજનેરા રાજ્ય સરકારી ઈજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ હેઠળ ગુજરાત રાજ્યની વિવિધ ૧૬ સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપક સભ્યો દ્વારા યથાશક્તિ આર્થિક સહાય કરવામાં આવી હતી. અધ્યાપક સભ્યો દ્વારા સ્વ. પ્રાધ્યાપકના પરિવારને કુર્લૂર. ૫,૮૬,૦૪૨/૨- જેટલી આર્થિક

સહાય અર્પણ કરવામાં આવી હતી. સરકારી ઈજનેરી કોલેજ, પાલનપુર તથા લોકલ યુનિટ દ્વારા ગુજરાત રાજ્યના મંડળના તમામ સભ્યો તેમજ આર્થિક સહાય કરનાર તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે અધ્યાપક સમુદાયનો સંદેશ સ્પષ્ટ છે પ્રશિક્ષક દિનની સાચી ઉજવણી માત્ર શિક્ષણ અને સન્માનમાં નહીં, પરંતુ જરૂરિયાતના સમયે એકબીજાની પડખે ઊભા રહેવામાં છે. આવી માનવતાપૂર્ણ સહયોગની પરંપરા અધ્યાપક સમુદાયની એકતા અને પરસ્પર જવાબદારીને વધુ મજબૂત બનાવે છે.

## જીપીએસસી દ્વારા લેવાતી પરીક્ષામાં પારદર્શિતાના લાવવા સામાજિક ક્રાંતિ અભિયાનના હોદ્દદારોનું આવેદનપત્ર



રાજકોટ, ગુ. જ. ૨૧ ત. ઉમેદવારોને મૌખિક કસોટીમાં ખુબ જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષામાં લેખિત અને મૌખિક પરીક્ષાના ગુણાંકનમાં અસમાનતા અને પારદર્શિતાના અભાવની ફરિયાદ ઉઠાવી આ બાબતે પગલા લેવાની માંગણી સાથે સામાજિક ક્રાંતિ અભિયાન સંસ્થાના હોદ્દદારો દ્વારા જલ્લા કલેક્ટરને આવેદનપત્ર ફરીયાદ છે. ત્યારે આ બાબતે તપાસ કરી જીપીએસસીની મૌખિક પરીક્ષાની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને જાહેર સેવા આયોગની વિવિધ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરનારા કેટલાક

# અમરેલીમાં ૬૩૪ કરોડનાં SD Pay સાયબર કૌભાંડનો પર્દાફાશ : કરોડોના ટ્રાન્ઝેક્શનમાં છ આરોપી પકડાયા

મોબાઈલ એપ.ના માધ્યમથી દૈનિક ઉંચા વળતર, કેશબેંક અને રેફરલ બોનસની લાલચ અપાતી હતી : ૧૦ લાખથી વધુ એપ. ડાઉનલોડ થઈ!



(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી: આરોપીઓ SD Pay/ Apna Pay એપ્લિકેશનના માલિક ધવલ પટેલ, આશિષભાઈ ગેડીયા, (રહે. સુરત), ભાવેશભાઈ ચૌહાણ, (રહે. સુરત), તથા SD Pay/ Apna Pay એપ્લિકેશનના પ્રમોટરો, રિરેક્ટરો, સંચાલકો, એજન્ટો અને અન્ય અજાણ્યા સહયોગીઓએ એકબીજાની સાથે મળી પૂર્વયોજિત ગુનાહિત કાવતરું રચી સંગઠિત રીતે જાહેર જનતાને ટૂંકા સમયમાં અસાધારણ નાણાકીય વળતર આપવાની લાલચ આપી SD Pay/Apna Pay નામની

અમરેલી સાયબર કાઈમનો મોટો પર્દાફાશ કરી : SD PAYના નામે રૂ.૬૩૪ કરોડના વ્યવહારો, સાથે ૬ આરોપીઓ ઝડપી પાડેલ છે. અમરેલી સાયબર કાઈમ પોલીસે ઓનલાઈન રોકાણના નામે ચાલતા મોટા નાણાકીય કૌભાંડનો પર્દાફાશ કરી કંપનીના રિરેક્ટર સહિત કુલ છ આરોપીઓને ઝડપી લેતાં સાયબર જગતમાં બળભળાટ મચી ગયો છે. પોલીસ તપાસમાં SD PAY અને Apna Pay નામની એપ્લિકેશન મારફતે લોકોને આકર્ષક દૈનિક વળતર અને રેફરલ બોનસની લાલચ આપી મોટા પાયે નાણાંનું રોકાણ કરાવવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર નેટવર્ક સાથે જોડાયેલા અલગ-અલગ કંપનીઓના બેન્ક ખાતાઓમાં અંદાજે રૂ.૬૩૪ કરોડ જેટલા નાણાકીય વ્યવહારો થયાનું તપાસમાં સામે આવ્યું છે. આ મામલે અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ મુજબ આરોપીઓ દ્વારા SD PAY એપ્લિકેશન મારફતે લોકોને રૂ.૧,૦૦૦થી લઈને

રૂપિયા ૫ લાખથી વધુ રકમનું રોકાણ કરાવવા માટે લાલચ આપવામાં આવતી હતી. રોકાણની રકમ પ્રમાણે દરરોજ ૦.૧૫ ટકાથી ૦.૩૦ ટકા સુધીનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવતી હતી. એટલું જ નહીં, અન્ય લોકોને એપ સાથે જોડવા માટે ૧૫ અલગ-અલગ લેયર સુધી રેફરલ બોનસ આપવાની યોજના પણ ચલાવવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓએ પોતાના રેફરલ મારફતે શરૂઆતના લેવલમાં લોકોને જોડ્યા બાદ તેમની નીચે અલગ-અલગ લેવલ ઊભા કરી નેટવર્કને મોટું બનાવ્યું હતું. પોલીસ તપાસમાં દોઢ લાખથી પોણા બે લાખ જેટલા લોકો આ નેટવર્ક સાથે જોડાયા હોવાનું સામે આવ્યું છે. એપ્લિકેશનના યુઝર્સની સંખ્યા પણ મોટી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. ૧૨ બેન્ક ખાતા સામે ૮૩ સાયબર ફરિયાદો: આ સમગ્ર કૌભાંડની તપાસ દરમિયાન અલગ-અલગ બેન્ક ખાતાઓની તપાસ કરતાં NCCRP પોર્ટલ પર ૧૨ બેન્ક ખાતાઓ વિરુદ્ધ દેશભરમાંથી કુલ ૮૩ સાયબર

ફોડની ફરિયાદો મળી આવી હોવાનું પોલીસ દસ્તાવેજોમાં જણાવાયું છે. આ ફરિયાદોમાં કુલ રૂ.૨૩,૦૮,૭૩,૫૬૭ની ફોડ રકમ તથા રૂ.૭૬,૮૪,૯૨૬ની ડિસ્ચુટેડ રકમ હોવાનું સામે આવ્યું છે. આ તમામ નાણાકીય વ્યવહારો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ આરોપીઓ સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિગત બેન્ક ખાતાઓની પણ તપાસ ચાલી રહી છે. કંપનીના રિરેક્ટર સહિત છ આરોપીઓ ઝડપાયા: આ કેસમાં પોલીસે નીચેના છ આરોપીઓને ઝડપી લીધા છે ૧. આશિષભાઈ

શરૂ કરી છે. સાથે જ આરોપીઓ સાથે સંકળાયેલી અન્ય કંપનીઓ, બેન્ક ખાતાઓ અને નાણાકીય વ્યવહારોની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વધુ આરોપીઓ અથવા વધુ નાણાકીય વ્યવહારો બહાર આવે તેવી શક્યતા છે.

**કૌભાંડને વ્યવસ્થિત ચલાવવા ૭ બોગસ કંપનીઓ અને ૧૫ બેંક ખાતાઓમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનની ચોંકાવનારી વિગતો ખુલી: દેશભરમાંથી સાયબર ફોડની રકમ જમા થઈ હોવાનું ખુલ્યુ**

ધરવામાં આવી રહી છે. સાત કંપનીઓના નામે ૧૫ બેન્ક ખાતાં: પોલીસ તપાસમાં નાણાં મેળવવા, સગેવગે કરવા અને રેફરલના વ્યવહારો માટે વિવિધ કંપનીઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. આ કંપનીઓ તથા તેમના નામે અલગ-અલગ બેન્કોમાં આશરે ૧૫ જેટલા બેન્ક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. આ ખાતાઓમાં અંદાજે રૂ.૬૩૪ કરોડ જેટલી રકમના વ્યવહારો થયાની વિગતો સામે આવી છે.

છગનભાઈ ગેડિયા, (મૂળ સાવરકુંડલા), હાલ સુરત.૨. ભાવેશભાઈ ધીરુભાઈ ચૌહાણ, (મૂળ સાવરકુંડલા), હાલ સુરત.૩. નિશી સત્યનારાયણ પ્રસાદ, (મહેસાણા), ૪. સોહિલભાઈ જીતેન્દ્રકુમાર મકવાણા, (મહેસાણા) ૫. નિરવકુમાર અરવિંદભાઈ પટેલ, (બલોલ, મહેસાણા) ૬. સૂર્યસિંહ જગતસિંહ રાઠોડ, માણસા, ગાંધીનગર, અને S.D. HUB કંપનીના રિરેક્ટર પોલીસે કંપનીના રિરેક્ટર સૂર્યસિંહ રાઠોડ સહિત તમામ આરોપીઓની પૂછપરછ

૬૩૪ કરોડના નાણાકીય નેટવર્કથી પોલીસમાં બળભળાટ: SD PAY એપ મારફતે રોકાણકારોને અસાધારણ વળતરની લાલચ આપી નાણાં એકત્રિત કરી અલગ-અલગ કંપનીઓ અને બેન્ક ખાતાઓ મારફતે સગેવગે કરાયા હોવાની પોલીસને આશંકા છે. સમગ્ર મામલે અમરેલી સાયબર કાઈમ દ્વારા નાણાં કચાંથી આવ્યા, કપા ખાતામાં ટ્રાન્સફર થયા અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે દિશામાં તપાસ વધુ તેજ બનાવવામાં આવી છે.

## સાવરકુંડલામાં વરસાદ ખેંચાતા ખેડૂતે ૧૫ વીધાના ખેતરમાં ગાયો ચરાવી દીધી

અમરેલી:સાવરકુંડલા તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા દોઢ મહિનાથી નોંધપાત્ર વરસાદ નહીં પડતા ખેતરમાં ઉભેલા કપાસ, મગફળી સહિતના પાક પાણીના અભાવે મુરઝાઈ રહ્યા છે. વરસાદના અભાવે પાકની સ્થિતિ દિવસે દિવસે કથળી રહી હોવાથી ખેડૂતોની મહેનત અને ખેતી પાછળ કરવામાં આવેલો ખર્ચ પાણીમાં જવાની ભીતિ ઊભી થઈ છે. વરસાદની આશાએ ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર, દવા, મજૂરી સહિતનો ખર્ચ કરીને વાવેતર કર્યું હતું. સાવરકુંડલા પંચકના ખેડૂત મગનભાઈ લાલજીભાઈ ડોબરીયાએ તેમણે પોતાના ૧૫ વીધાના ખેતરમાં વાવેલો પાક વરસાદના અભાવે બળી જતા આખરે ગાયોને ચરવા માટે ખેતરમાં છોડી દીધી હતી. જે ખેતરમાં થોડા સમય પહેલાં લીલોછમ પાક લહેરાતો હતો, ત્યાં હવે ઉભા પાકની જગ્યાએ પશુઓ ચરતા જોવા મળ્યા હતા. છેલ્લા દોઢ મહિનાથી વરસાદનું એક પણ ટીપું પડ્યું નથી. વરસાદના અભાવે ખેડૂતનો પાક સાબળી ગયો હોવાથી ૧૫ વીધામાં કરેલ વાવેતર પાક બચાવવા માટે



ખૂબ મહેનત કરી અને એક લાખ રૂપિયાથી વધુનો ખર્ચ પણ કર્યો હતો. વરસાદ ન પડતાં આખરે પાક બચાવી શકાયો નહીં. કંટાળીને ખેતરમાં ગાયો ચરવા માટે છોડી દીધી છે. સાવરકુંડલા તાલુકામાં ખેડૂતોએ ખેતી પાછળ કરેલો ખર્ચ પરત મળવાની તો વાત દૂર રહી, પરંતુ હવે ઉભો પાક પણ બચ્યો નથી. વરસાદના અભાવે એક તરફ ઉત્પાદનની આશા ધૂંધળી બની છે તો બીજી તરફ આગામી સિઝનની ખેતી અને ઘરખર્ચ સહિતની આર્થિક જવાબદારીઓ કેવી રીતે પૂરી કરવી તેની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. સાવરકુંડલા તાલુકાના અનેક ગામોમાં

ખેડૂતો હાલ વરસાદની રાહ જોઈ રહ્યા છે. અમારે આ દોઢક મહિનાથી વરસાદનું એક પણ ટીપું પડેલું નથી. એટલે અમારો આ પાક અત્યારે સાવ બળીને ખાખરી ગયો છે. અને આ માસ ૧૫ વીધાનું વાવેતર છે. છેવટે અમે કંટાળી અને આ ગાયો માટે ચારવા આપી દીધું છે. ૧૫ વીધાનો પાક નિષ્ફળ ગયો છે. અમારે લગભગ આમાં એક લાખ ઉપરનો ખર્ચો થઈ ગયો છે. છતાંય હવે અમે કંટાળી ગયા એટલે ગાયોને ચારવા માટે આપી દીધું છે. મગનભાઈ લાલજીભાઈ ડોબરીયા, સાવરકુંડલાના ખેડૂત ખેતરમાં પાક લીલોછમ થાય તેવી આશા હતી, પરંતુ વરસાદ ખેંચાતા હવે છોડ સુકાઈ ગયા છે. જો તાત્કાલિક સારો વરસાદ નહીં પડે તો ખેડૂતોને મોટું નુકસાન થશે. સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવું જોઈએ. વરસાદની આશાએ વાવેતર કર્યું હતું, પરંતુ લાંબો સમય વરસાદ નહીં પડતા ઉભો પાક બળી રહ્યો છે. ખેતી પાછ? કરેલો ખર્ચ પણ પરત મળે તેવી સ્થિતિ નથી. હવે સરકાર ખેડૂતોની સ્થિતિ સમજીને પાક વીમા અને રાહત સહાય ઝડપથી આપે તે જરૂરી છે.

## ખાંભાની શાળામાંથી ૬ નળ અને CCTV કેમેરાની ચોરી

અમરેલી: ખાંભા નગરની શ્રી કુમાર પે. સેન્ટર શાળામાં ફરી એકવાર ચોરી થઈ છે. જન્માષ્ટમીની રજાઓ દરમિયાન અજાણ્યા ચોરોએ શાળામાંથી ૬ પાણીના નળ અને ૧ CCTV કેમેરાની ચોરી કરી છે. શાળાના આચાર્યએ ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદ મુજબ, ૧ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૫ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી જન્માષ્ટમીની રજાઓ હતી. ૭ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ સવારે શાળા ખોલવામાં આવી ત્યારે આ ચોરીની ખબર પડી હતી. ચોરો શાળાના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર રીતે ધૂસી ગયા હતા.



તેઓ વિદ્યાર્થીઓ માટેના પીવાના પાણીના સ્ટેન્ડ પરથી લગભગ ૬ પાણીના નળ પાઈપલાઈન સાથે તોડીને લઈ ગયા હતા. આ ઉપરાંત, શાળાના મુખ્ય બિંદીગના આગળના ભાગમાં સુરક્ષા માટે લગાવેલો ૧ ઝૂઝફ કેમેરો પણ ચોરી થયો છે. નોંધનીય છે કે, આ શાળામાં પહેલા પણ રજાઓ દરમિયાન નાની-મોટી ચોરી અને તોડફોડ થઈ

છે. પોલીસને આ અંગે જાણ પણ કરવામાં આવી હતી. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે શાળામાં ભણતા બાળકોને પીવાના પાણીની સુવિધામાં તકલીફ પડે છે અને શાળાની સુરક્ષા સામે જોખમ થાય છે. શાળા તંત્ર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તેમણે ઘટનાસ્થળની તપાસ કરીને ચોરાયેલો સરકારી સામાન જલદી પાછો મળે તેવી વિનંતી કરી છે. ચોરો સામે કડક પગલાં લેવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે શાળા વિસ્તારમાં રાત્રિના સમયે અને રજાઓમાં પોલીસ પેટ્રોલિંગ રાખવા પણ વિનંતી કરાઈ છે.

## અમરેલીમાં આજે સહકારનો મહાકુંભ દિલીપ સંઘાણીના માર્ગદર્શન હેઠળ અમરેલી ડેરી ખાતે યોજાશે સહકાર પરિસંવાદ

(મિલાપ રૂપારેલ દ્વારા)અમરેલી: અમરેલી જિલ્લામાં સહકારી ક્ષેત્રને વધુ વેગ આપવા માટે આજે બુધવારના રોજ અમર ડેરી, ધારી રોડ, અમરેલી ખાતે સહકારી સંસ્થાઓની સંયુક્ત વાર્ષિક સાધારણ સભા તેમજ સહકાર પરિસંવાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દિલીપ સંઘાણીના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ કાર્યક્રમમાં મત્સ્યદોગ, પશુપાલન, ડેરી અને પંચાયત વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રો. એસ.પી.સિંહ બઘેલ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ આવતીકાલે સવારના ૯ કલાકે યોજાશે જેમાં અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.,

અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., અમરેલી જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી. અને અમરેલી જિલ્લા સહકારી સંઘ લી.ની સંયુક્ત વાર્ષિક સાધારણ સભા યોજાશે. સાથે જ કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ (કાર્ડ) દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા કૃષિ વર્ષ-૨૦૨૬ અંતર્ગત સહકાર પરિસંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી ખાતે વિવિધ સહકારી સંસ્થાઓની સંયુક્ત વાર્ષિક સાધારણ સભા યોજવાની પહેલ દિલીપ સંઘાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જે સફળ સાબિત થયા બાદ અન્ય સ્થળોએ પણ આવા સંયુક્ત આયોજનને પ્રોત્સાહન મળ્યું છે. આ વખતના કાર્યક્રમમાં સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડૂતો, પશુપાલકો, શ્રમિકો, મહિલાઓ તેમજ સહકારી

આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. કાર્યક્રમ દરમિયાન ભારત સરકારની રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજના અને આર.કે.વી.વાય. યોજના અંતર્ગત વિવિધ વિકાસલક્ષી એકમોનું લોકાર્પણ પણ કરવામાં આવશે. જેમાં સેન્ટર ઓફ એક્સલન્સ, એગ્રિબો ટ્રાન્સફર લેબોરેટરી, આઈસ્ટ્રીમ પ્લાન્ટ તથા પનીર પ્લાન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સહકારી ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓ તથા સેવા સહકારી અને દૂધ સહકારી મંડળીઓને પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવશે. સહકાર પરિસંવાદમાં જિલ્લાભરની સહકારી સંસ્થાઓના પ્રમુખો, રિરેક્ટરો, મંડળીના પ્રમુખ-મંત્રીઓ, સભાસદો, ખેડૂતો, પશુપાલકો, શ્રમિકો, મહિલાઓ,

સહકારી આગેવાનો ઉપરાંત સાંસદો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સંગઠનના હોદ્દદારો અને માર્કેટયાર્ડના ચેરમેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, અમરેલી જિલ્લા ખરીદ-વેચાણ સહકારી સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા, અમરેલી જિલ્લા કાયદેસર અમલવારી કરી ઇસમને નિયત વિસ્તારની હદ બહાર મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

## કથીવદર પરા નજીક કારની ટક્કરે બાઈક સવારનું ૭ દિવસ બાદ મોત નિપજ્યું

અમરેલી:રાજુલામાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર કથીવદર પરા ગામના પાટિયા નજીક પુરડાંએ અને બેઝિકરાઈથી દોડતી કારના ચાલકે બાઈકને અડકે તેવા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકચાલક સહિત ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી, જેમાં એકનું સાત દિવસ બાદસારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. ગત તા. ૩૧ ઓગસ્ટના રોજ સોજના આશરે સવા આઠ વાગ્યે વીસળીયા ગામના રહેવાસી અને ખેતીકામ કરતા રમેશભાઈ દેવાભાઈ ભાલીયા તેમના મિત્રો વાઘજીભાઈ શિયાળ અને શેલેષભાઈ જોળીયાને GJ-14-AQ-9153 નંબરના બાઈક પર બેસાડીને કથીવદર પરા ગામથી વીસળીયા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વિકટર ગામ

તરફથી આવેલી GJ-01-RG-2439 નંબરની કારના ચાલકે કાર પુરડાંએ અને બેઝિકરાઈથી હંકારી લાવી બાઈક સાથે જોરદાર ટક્કર મારી હતી. અકસ્મતમાં રમેશભાઈને પગમાં ફેંક્યાર સહિત ઈજાઓ પહોંચી હતી. જ્યારે વાઘજીભાઈ શિયાળને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સાત દિવસની સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. તેમજ શેલેષભાઈ જોળીયાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે રમેશભાઈ ભાલીયાની ફરિયાદના આધારે GJ-01-RG-2439 નંબરની કારના ચાલક સામે ફરિયાદ આપતા પીપાવાવ મેરિન પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

## વડિયામાં ૫ લાખની ખંડણીની ધમકી બાદ ઝેરી દવા પીધેલા યુવકનું મોત ૪ સામે દુષ્પ્રેરણાની કલમ હેઠળ પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો

અમરેલી:વડિયા તાલુકાના કોલગ્ર ગામની સીમ વિસ્તારમાં યુવતીનો હાથ પકડ્યો હોવાનું કહી, પાંચ લાખ રૂપિયા આપવાની ધમકી અને કથિત ત્રાસથી એક યુવકે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. વડિયાના કોલગ્ર ગામે અરવિંદભાઈ કલ્યાણભાઈ રાઠીયાની વાડીએ રહેતા જીનુબેન ઠાકરાલ્યા મૂળ મધ્યપ્રદેશના વતની છે. તા. ૪ સપ્ટેમ્બરે ધરમ બરસીયા ઠાકુર, રાયસિંગ ઠાકુર અને જીતેન ઠાકુરે મહિલાના પતિ અનીલભાઈ ભારશીંગભાઈ ઠાકરાલ્યા પર યુવતીનો હાથ પકડ્યાનો આક્ષેપ કરી માર માર્યો હતો. ત્યારબાદ ગઈ કાલે સપ્ટેમ્બરના સોજના આશરે ચાર વાગ્યાના અરસામાં ચારેય શખ્સો અનીલભાઈ જયાં રહેતા હતા તે વાડીએ

એકસાથે આવ્યા હતા. અને હાથ પકડવા તથા બળજબરી કરવાને લઈ તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે સમાધાન કરવું હોય તો રૂપિયા પાંચ લાખ આપવા પડશે નહીતર અમે મારી નાખીશું કહી ધમકી આપી હતી. જેથી મહિલાના પતિ અનિલભાઈને મનમાં લાગી આવતા રહેણાંક મકાનમાં પોતાની મેળે ઝેરી દવા પીધી હતી. જાણકારી મળતા પરિવાર દ્વારા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. વડિયા પોલીસે ધરમસિંગ બરસીયા ઠાકુર, રાયસિંગ અનાજીયા ઠાકુર, જીતેન જાંરસીયા ઠાકુર અને પ્રેમસિંગ બરસીયા ઠાકુર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.